



નૂતન નાગરિક
સહકારી બેંક લિ.

મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ બેંક

સહકાર
થી
સમૃદ્ધિ

૫૩^{મો}
વાર્ષિક અહેવાલ
૨૦૨૩ - ૨૦૨૪



ઍકિંગ સંલગ્ન વિષયો પર ટ્રેનીંગ મેળવી રહેલા સ્ટાફ મિત્રો.



વર્ષ દરમિયાન કાર ફાઇનાન્સમાં અગ્રેસર રહેનાર ઍકની લો-ગાર્ડન તથા ડ્રાઇવઇન રોડ શાખાઓ વતી ડિરેક્ટર્સશ્રીઓના હસ્તે એવોર્ડ સ્વીકારતા શાખાના મેનેજરશ્રીઓ.



ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ઍક દ્વારા યોજાયેલ રમતોત્સવમાં બેડ-મિન્ટન માં ટ્રોફી જીતનાર (પ્રથમ ક્રમ) શ્રીમતી શિવાનીબેન શાહનું અભિવાદન કરતા બોર્ડના સભ્યશ્રીઓ.



બાળકોમાં ઍકિંગ તથા બચત વિષે સમજ કેળવાય તે હેતુથી શહેરની વિવિધ શાળાઓના બાળકોને ટ્રેનીંગ આપતા સ્ટાફ મિત્રો.



ઇલ્કલ કો-ઓપ. ઍક લિ., બાગલકોટ, કર્ણાટકનાં બોર્ડ મેમ્બર્સ દ્વારા ઍકની શુભેચ્છા મુલાકાત દરમિયાન સ્મૃતિચિન્હ અર્પણ કરતા ઍકના સ્ટાફ મિત્રો.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

Regd. Office : Central (Admn.) Office :

Opp. Samartheshwar Mahadev, Nr. Law Garden, Ellisbridge, Ahmedabad-380 006.

Tel.: 079-26443724, 26444558 E-mail: admin@nutanbank.com Website: www.nutanbank.com

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

- ૧ શ્રી ધનાભાઈ ચીમનલાલ શાહ અમદાવાદ ચેરમેન
- ૨ શ્રી આનંદભાઈ શરદચંદ્ર પટેલ વાઈસ ચેરમેન

Board of Directors

- 1 Shri Dhanabhai Chimanlal Shah Ahmedabad Chairman
- 2 Shri Anandbhai Sharadchandra Patel Vice Chairman

ડિરેક્ટર્સ

- ૩ શ્રી માલવભાઈ મહેન્દ્રભાઈ ફડિયા અમદાવાદ
- ૪ શ્રી સતીષચંદ્ર સંપતરાજ શાહ
- ૫ શ્રી રાજેન્દ્રભાઈ માણેકલાલ પટેલ
- ૬ શ્રી સુનીલભાઈ હિંમતભાઈ શાહ
- ૭ શ્રી પાવનભાઈ રમેશચંદ્ર પરીખ
- ૮ શ્રી રાહીલભાઈ નિમેષભાઈ શાહ
- ૯ શ્રીમતી નીનાબેન સ્નેહલભાઈ લાવસી
- ૧૦ શ્રીમતી પાર્થિવીબેન મિત્તલભાઈ શાહ
- ૧૧ શ્રી શિરીષભાઈ અનંતભાઈ જોષી (કો.ઓપ્ટ. પ્રોફેશનલ ડિરેક્ટર)

Directors

- 3 Shri Malavbhai Mahendrabhai Fadia Ahmedabad
- 4 Shri Satishchandra Sampatraj Shah
- 5 Shri Rajendrabhai Maneklal Patel
- 6 Shri Sunilbhai Himmatbhai Shah
- 7 Shri Pavanbhai Rameshchandra Parikh
- 8 Shri Rahilbhai Nimeshbhai Shah
- 9 Smt. Ninaben Snehalbhai Lavsi
- 10 Smt. Parthiviben Mittalbhai Shah
- 11 Shri Shirishbhai Anantbhai Joshi (Co-Opt. Prof. Director)

બોર્ડ ઓફ મેનેજમેન્ટ (એક્સટર્નલ મેમ્બર્સ)

- ૧ શ્રી ચીનુભાઈ નાથાલાલ શાહ (C.A.)
- ૨ શ્રી ઉમેશચંદ્ર કનૈયાલાલ ત્રિવેદી (LLB, CAIIB, ICWA)
- ૩ શ્રી ચંપકલાલ મોહનલાલ શાહ (CAIIB)

Board of Management (External Members)

- 1 Shri Chinubhai Nathalal Shah (C.A.)
- 2 Shri Umeshchandra Kanaiyalal Trivedi (LLB, CAIIB, ICWA)
- 3 Shri Champaklal Mohanlal Shah (CAIIB)

Auditor

M/s. Jain Kedia & Sharma
Chartered Accountants

Shri Ashok Kapadia
General Manager &
Chief Executive Officer



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

Regd. Office : Central (Admn.) Office :
Opp. Samartheshwar Mahadev, Nr. Law Garden, Ellisbridge, Ahmedabad-380 006.
Tel.: 079-26443724, 26444558 E-mail: admin@nutanbank.com Website: www.nutanbank.com

બેંકર્સ :

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
યુકો બેંક
બેંક ઓફ બરોડા
એચડીએફસી બેંક
આઈસીઆઈસીઆઈ બેંક
આઈડીબીઆઈ બેંક
કોટક મહિન્દ્રા બેંક
કરૂર વૈશ્ય બેંક
યસ બેંક
કેથોલીક સીરીઅન બેંક
આઈડીએફસી ફર્સ્ટ બેંક
ઈન્ડસઈન્ડ બેંક
આરબીએલ બેંક
એક્સીસ બેંક
અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક
ગુજરાત રાજ્ય સહકારી બેંક
ઉજ્જવન સ્મોલ ફાઈનાન્સ બેંક
ઈક્વીટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક
એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક

BANKERS :

Reserve Bank of India
State Bank of India
Union Bank of India
UCO Bank
Bank of Baroda
HDFC Bank
ICICI Bank
IDBI Bank
Kotak Mahindra Bank
Karur Vysya Bank
Yes Bank
Catholic Syrian Bank
IDFC First Bank
IndusInd Bank
RBL Bank
Axis Bank
Ahmedabad District Co. Op. Bank
Gujarat State Co. op. Bank
Ujjivan Small Finance Bank
Equitas Small Finance Bank
AU Small Finance Bank

Estd. on : 4-10-1971

Banking Lic. No. UBD GJ 627P Dt. 30-10-1986

Scheduled Banks' status : 29-01-2000

Reg. No. MSCS/CR/114/2000 Dt. 13.11.2000



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

ત્રેપનમી વાર્ષિક સાધારણ સભાની નોટીસ

મહેરબાન સભાસદ સાહેબ,

આથી બેંકના સર્વે સભાસદોને જણાવવામાં આવે છે કે બેંકની ત્રેપનમી (પંચમી) વાર્ષિક સાધારણ સભા તા. ૧૧-૦૭-૨૦૨૪ ને ગુરુવારના રોજ બપોરે ૩.૦૦ કલાકે જે.બી. ઓડીટોરીયમ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA), આઈ.આઈ.એમ. રોડ, અમદાવાદ ખાતે નીચે દર્શાવેલ કામકાજ સારૂ મળશે તો આપને હાજર રહેવા વિનંતી છે.

: કાર્યસૂચિ :

- તા. ૦૩-૦૮-૨૦૨૩ની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપવા.
- બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી રજૂ થયેલા હિસાબી વર્ષ ૨૦૨૩-૨૦૨૪ નો રિપોર્ટ, બેંકનું ઓડિટેડ સરવૈયું અને નફા-તોટાના હિસાબો મંજૂર કરવા.
- ઓડિટર્સના રિપોર્ટની નોંધ લેવા.
- બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી ભલામણ થયેલ નફાની વહેંચણી તથા સૂચિત ડિવિડન્ડ મંજૂર કરવા.
- હિસાબી વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે બેંકનું વાર્ષિક બજેટ મંજૂર કરવા.
- હિસાબી વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે બેંકના હિસાબ તપાસવા માટે ઓડિટરની નિયુક્તિ કરવા (RBIની માર્ગદર્શિકા મુજબ) તથા તેઓનું મહેનતાણું નક્કી કરવા.
- બોર્ડના સભ્યો અથવા ચીફ એક્ઝીક્યુટીવના સગા (RBIની વ્યાખ્યા મુજબ) હોય તેવા કર્મચારીઓની નોંધ લેવા.
- બેંકના બાકીદારો પાસેથી વસુલ ન આવતી લેણી રકમ માંડી વાળવાની મંજૂરી બાબત.
- ચેરમેનશ્રીની મંજૂરીથી જે કંઈ કામકાજ રજૂ થાય તે ઉપર વિચારણા કરી નિર્ણય લેવા.

અમદાવાદ
તા. : ૧૨/૦૬/૨૦૨૪

બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સૂચનાથી
અશોક કાપડીયા
જનરલ મેનેજર એન્ડ સી.ઈ.ઓ.

-: નોંધ :-

- સભામાં ઉપસ્થિત રહેનાર અધિકૃત સભાસદે હાજરીની સહી કરવાની રહેશે.
- સભાસદ સિવાય અન્યને વાર્ષિક સાધારણ સભામાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવા વિનંતી.
- કોરમના અભાવે મીટીંગ મુલતવી રહેશે તો તે જ દિવસે અડધા કલાક બાદ તે જ સ્થળે ફરીથી મળશે.
- જે સભાસદોને વાર્ષિક અહેવાલની નકલ જોઈતી હોય તેઓએ બેંકની રજીસ્ટર્ડ ઓફિસ પરથી કામકાજના સમય દરમિયાન મેળવી લેવા વિનંતી છે. સભાસદોને વાર્ષિક સાધારણ સભાની નોટીસ તેઓના બેંકમાં નોંધણી કરાવેલ મોબાઈલ નંબર પર SMS થી લીંક દ્વારા મોકલવામાં આવેલ છે તથા જે સભાસદોએ બેંકમાં E-mail ID ની નોંધણી કરાવેલ છે તેઓને વાર્ષિક સાધારણ સભાની નોટીસ E-mail દ્વારા મોકલવામાં આવેલ છે.
- જે સભાસદને સરવૈયા તથા નફા-તોટાના હિસાબો અંગે વધુ માહિતી જોઈતી હોય અગર પૂછપરછ કરવી હોય તો સાધારણ સભાની તારીખથી સાત દિવસ અગાઉ બેંકમાં લેખિત માંગણી મોકલી આપવા વિનંતી છે, જેથી સભામાં તેનો ખુલાસો કરી શકાય.
- બેંકના પેટા-કાયદા અનુસાર બેંકના દરેક સભાસદે બેંકની એક સેવા લેવી જરૂરી છે. બેંકના દરેક સભાસદ/સભાસદ પેઢીઓને વિનંતી કે તેઓ આપણી બેંકમાં બચત/ચાલુ ખાતુ ખોલાવે. જેથી તેમને ચૂકવવા પાત્ર ડિવિડન્ડની રકમ ખાતામાં જમા કરવામાં સુગમતા રહે.
- સર્વે સભાસદોને બેંકના રેકૉર્ડમાં નોમીની ની વિગતની નોંધ કરાવી લેવા વિનંતી.
- રિઝર્વ બેંકના આદેશ અનુસાર દરેક સભાસદના KYC સંબંધિત પુરાવા લેવાનું ફરજિયાત છે. આથી સભાસદોને KYC સંબંધિત પુરાવા બેંકમાં પહોંચાડવા વિનંતી.
- જે સભાસદો ચાર શેર્સ ધરાવતા હોય તેઓએ બેંકના નિયમ મુજબ ઓછામાં ઓછા ચાલીસ (૪૦) શેર્સ ધરાવવા જરૂરી છે. આ માટે નજીકની શાખાનો સંપર્ક કરવા વિનંતી.
- સભાસદોને તેઓના ઈ-મેઈલ આઈડી તથા મોબાઈલ નંબરની બેંકમાં નોંધણી કરાવવા વિનંતી. જેથી ભવિષ્યમાં પણ અગત્યની માહિતી ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલી શકાય જેનાથી પર્યાવરણની જાળવણીમાં આપ પણ સહભાગી થઈ શકશો.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી ચેરમેન દ્વારા રજૂ થયેલ અહેવાલ

માનનીય સહકારી સભાસદ મિત્રો,
સત્કાર,

આપણી બેંકની ૫૩મી વાર્ષિક સાધારણ સભામાં આપ સર્વેનું સ્વાગત કરતા હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. આપણી બેંકે યશસ્વી કામગીરીના ૫૩ વર્ષ પૂરા કર્યા છે. આ ગૌરવપૂર્ણ વર્ષો દરમિયાન બેંકે તમામ ક્ષેત્રે સારી અને નક્કર પ્રગતિ કરી છે. આ સમગ્ર કામગીરીનો યશ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, બિઝનેસ ડેવલપમેન્ટ સમિતીના સભ્યશ્રીઓ, બેંકના સભાસદો, ગ્રાહકો, શુભેચ્છકો અને બેંકના કર્મચારીઓએ આપેલા અવિરત સહકારને ફાળે જાય છે. હું સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

તા. ૩૧-૩-૨૦૨૪ ના રોજ પૂરા થતા હિસાબી વર્ષના ઑડિટ થયેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગમાં મંજૂર થયેલ અહેવાલ આપ સમક્ષ બોર્ડના મારા સાથી સભ્યો વતી રજૂ કરતાં આનંદ અનુભવું છું. જેમાં બેંકના તમામ વ્યવહારોની માહિતીનો સમાવેશ કરી, હિસાબોને સંપૂર્ણ પારદર્શકતા સાથે રજૂ કરવાનો વિનમ્ર પ્રયાસ કરેલ છે.

બેંકની પ્રગતિના સૂચક આંકડા

(રૂ. કરોડમાં)

વિગત	૩૧-૦૩-૨૦૨૩	૩૧-૦૩-૨૦૨૪	વધારો	વધારો %
ફિક્સ્ડ ડિપોઝીટ	૧૫૮૫.૮૪	૧,૮૦૦.૬૯	૨૧૪.૮૫	૧૩.૫૫
કરન્ટ ડિપોઝીટ	૧૭૨.૩૫	૨૦૧.૮૬	૨૯.૫૧	૧૭.૧૨
સેવિંગ ડિપોઝીટ	૪૪૭.૮૭	૫૨૮.૧૧	૮૦.૨૪	૧૭.૯૨
કુલ ડિપોઝીટ	૨૨૦૬.૦૬	૨,૫૩૦.૬૬	૩૨૪.૬૦	૧૪.૭૧
ધિરાણ	૧૩૨૭.૫૯	૧,૫૧૩.૩૫	૧૮૫.૭૬	૧૩.૯૯
શેર કેપિટલ	૨૪.૪૦	૨૩.૯૪	-૦.૪૬	-૧.૮૯
ટેક્ષ્ટ પહેલાનો નફો	૧૧.૧૯	૧૬.૯૭	૫.૭૮	૫૧.૬૫
ચોખ્ખો નફો	૭.૦૮	૧૪.૪૨	૭.૩૪	૧૦૩.૬૭
અનામત ભંડોળ	૨૭૨.૬૭	૨૭૯.૧૧	૬.૪૪	૨.૩૬
સ્પેડ (ઈન્ટેસ્ટ)	૩.૦૩	૨.૯૪	-૦.૦૯	-૨.૯૭
નેટ ઈન્ટેસ્ટ ઈન્કમ	૫૦.૪૯	૪૯.૫૨	-૦.૯૭	-૧.૯૨
રોકાણ	૮૭૪.૪૬	૯૭૧.૫૭	૯૭.૧૧	૧૧.૧૧
CRAR	૧૫.૭૯	૧૫.૩૧	-૦.૪૮	-૩.૦૪
ગ્રોસ એનપીએ	૧.૩૮%	૧.૦૬%	-૦.૩૨	-૨૩.૧૯
નેટ એનપીએ	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦

ભારતનું અર્થતંત્ર આંતરિક તથા બાહ્ય અનેક પડકારો હોવા છતાં મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. જેના કારણે બેંકોના ગુણવત્તા ધરાવતા ધિરાણોમાં વૃદ્ધિ થવાની શક્યતાઓ છે. ૨૦૩૦ સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બને તે પણ સંભાવનાઓ છે. ભારતનો GDP વૃદ્ધિ દર વર્ષ ૨૦૨૩-૨૪ માં ૭.૬% જેટલો રહેલ હતો. જે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૮% જેટલો રહેવાનું અનુમાન છે. ધિરાણનો વૃદ્ધિ દર પણ વર્ષ ૨૦૨૪-૨૫ માં આશરે ૧૫% રહે તેવું અપેક્ષિત છે. વળી, વર્ષ ૨૦૨૪-૨૫ માં કુળાવાનો દર ૪.૫૦% ની આસપાસ રહે તેવી શક્યતા છે. રિઝર્વ બેંક દ્વારા પણ સતત આઠ વખતથી રેપો રેટમાં (૬.૫૦%) બદલાવ કરવામાં આવેલ નથી તથા દેશની અર્થવ્યવસ્થા પ્રત્યેના દૃષ્ટિકોણમાં પણ બદલાવ કરેલ નથી. વધુમાં વિતેલા વર્ષ દરમિયાન રિઝર્વ બેંક દ્વારા અર્બન કો.ઓપરેટીવ બેંકીંગ ક્ષેત્રને મજબૂત બનાવવા સિસ્ટમ તથા પ્રક્રિયામાં ઘણા ફેરફારો કરવામાં આવેલ છે.

વર્ષ દરમિયાન ટેકસ્ટાઈલ, મેટલ વગેરે ઉદ્યોગોઓએ થોડા ઘણા અંશે મંદીનો સામનો કરવો પડ્યો. આમ છતાં રીટેઈલ ફાઈનાન્સ જેવાં કે હાઉસિંગ લોન, કાર લોન વગેરેમાં સારી એવી વૃદ્ધિ જોવા મળી હતી. આપણી બેંકે સૌથી વધુ સ્પર્ધાત્મક ધોરણે કારનું ધિરાણ કરેલ હતું. વર્ષ દરમિયાન આપણી બેંકે રૂ. ૯૭.૯૬ કરોડનું કાર ધિરાણ કર્યું હતું. જેના કારણે બેંકના ગ્રાહક વર્ગમાં ઘણો વધારો થઈ શક્યો છે.

બેંક દ્વારા લઘુ તથા મધ્યમ કદના ઉદ્યોગોને પણ સ્પર્ધાત્મક દરે ધિરાણ કરવામાં આવેલ હતું.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

બેંકની શાખાઓ :

બેંકની કુલ ૨૩ શાખાઓ પૈકી ૨૧ શાખાઓ અમદાવાદમાં, ૧ શાખા અંધેરી (વેસ્ટ), મુંબઈ તથા ૧ શાખા રીંગ રોડ, સુરત ખાતે અદ્યતન સુવિધાથી સુસજ્જ છે. બેંકની ૧૮ શાખાઓ પોતાની માલિકીના સુંદર મકાનમાં અદ્યતન ફર્નીચર અને સુવિધા સાથે કામકાજ કરી રહી છે.

શેર ભંડોળ :

બેંકનું અધિકૃત શેર ભંડોળ રૂ. ૩૦ કરોડ મંજૂર થયેલ છે. બેંકના સભાસદોની સંખ્યા તા. ૩૧-૦૩-૨૦૨૪ ના રોજ ૨૪,૦૮૩ થઈ છે. તા. ૩૧-૦૩-૨૦૨૪ સુધીમાં ભરપાઈ થયેલું શેર ભંડોળ રૂ. ૨૩.૯૪ કરોડ થયેલ છે.

થાપણ સુરક્ષા વિમો :

રિઝર્વ બેંકના તા. ૦૪-૦૨-૨૦૨૦ ના પરિપત્ર મુજબ રૂ. ૫.૦૦ લાખ (પાંચ લાખ પુરા) સુધીની થાપણ DICGC વિમા અંતર્ગત સુરક્ષિત છે. આપણી બેંકે તા. ૩૦-૦૯-૨૦૨૪ સુધીનું DICGC ને પ્રિમીયમ ચુકવેલ છે.

સીનીયર સીટીઝન (વરિષ્ઠ નાગરિક)ને ફિક્સ્ડ ડિપોઝીટ ઉપર વધુ વ્યાજ :

આપણી બેંકમાં સીનીયર સીટીઝન (વરિષ્ઠ નાગરિકો) ને ૩૬૪ દિવસ કે તેથી વધુ સમય માટેની ફિક્સ્ડ ડિપોઝીટ ઉપર પ્રવર્તમાન ડિપોઝીટના વ્યાજ દર કરતાં હાલમાં ૦.૫૦% વધુ વ્યાજ દર આપવામાં આવે છે.

બેંક ગેરંટી :

આપણી બેંકની બેંક ગેરંટી ગુજરાત રાજ્યના દરેક ડીપાર્ટમેન્ટમાં સ્વીકારાય છે. તે અંગેની મંજૂરી ગુજરાત સરકારના ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટમાંથી મળેલ છે. આપણી બેંકે ઈન્સ્યુરન્સ એલ.સી., બેંક ગેરંટી તથા ફોરેન એલ.સી. માટે વિવિધ બેંકો સાથે વ્યવસ્થા કરેલ છે.

કાર્યકારી ભંડોળ :

તા. ૩૧-૩-૨૦૨૪ ના રોજ બેંકનું કાર્યકારી ભંડોળ રૂ. ૨૮૫૩.૯૪ કરોડ થયેલ છે.

નફો અને ફાળવણી :

બેંકનો ઈન્કમેટેક્સ પહેલાનો વહેંચણી પાત્ર નફો રૂ. ૨૦.૯૭ કરોડ થયો છે. તેમાંથી ઈન્કમેટેક્સ માટેના રૂ. ૨.૫૫ કરોડ બાદ કરતા કુલ નફો રૂ. ૧૮.૪૨ કરોડ થયેલ છે. જેની નીચે દર્શાવેલ ફાળવણીને આપ સૌ બહાલી આપશો તેવી અપેક્ષા રાખુ છું.

ફાળવણીની વિગત

	ફાળવેલી રકમ રૂ. પૈસા
૧. રીઝર્વ ફંડ ૨૫%થી ઓછી નહીં તેટલી રકમ	૫,૦૦,૦૦,૦૦૦.૦૦
૨. કો. ઓ. એજ્યુકેશન ફંડ ૧%	૧૮,૪૨,૩૦૧.૦૦
૩. અનફોરસીન લોસીસ રીઝર્વ ફંડ ૧૦%	૧,૮૪,૨૩,૦૧૨.૦૦
૪. સભાસદોને ૧૨% લેખે ડિવિડન્ડ	૨,૮૯,૪૧,૭૦૫.૦૦
૫. બીલ્ડીંગ ફંડ ખાતે ૪૦% સુધી	૧,૦૭,૩૧,૧૧૧.૦૦
૬. મેમ્બર્સ ઈન્સ્ટેન્ટીવ ફંડ ખાતે ૨૦% સુધી	૪૧,૫૬,૪૩૦.૦૦
૭. કો. ઓપરેટીવ એજ્યુકેશન ફંડ ખાતે ૧૦% સુધી (મેમ્બર્સ/કર્મચારી)	૧,૧૮,૦૩૯.૦૦
૮. ઈન્વેસ્ટમેન્ટ ફલકચ્યુએશન રીઝર્વ (નવુ) ૬૦% સુધી	૬,૫૦,૦૦,૦૦૦.૦૦
૯. I.T./સાઈબર સિક્યોરિટી રીઝર્વ ૨૫% સુધી	૫૦,૦૦,૦૦૦.૦૦
૧૦. બેલેન્સ રકમ રીઝર્વ ફંડ ખાતે લઈ ગયા	૧૭,૫૧૮.૦૦
સરવાળો	૧૮,૪૨,૩૦,૧૧૬.૦૦

ઉપરોક્ત નફાની વહેંચણી કર્યા બાદ બેંકનું સ્વભંડોળ રૂ. ૩૦૩.૦૫ કરોડ થવા જાય છે. જે ગત વર્ષે રૂ. ૨૯૭.૦૮ કરોડ હતું. બેંકના સ્વભંડોળમાં રૂ. ૬૮.૫૧ કરોડ બેંકની વિવિધ પ્રાંચોની સ્થાવર મિલકતો જેવી કે જમીન અને મકાનના પુનઃમુલ્યાંકનના છે.

ડિવિડન્ડ :

બેંકના વસુલ આવેલ શેર ભંડોળ ઉપર ૧૨% લેખે ડિવિડન્ડ વહેંચવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી હું ભલામણ કરું છું.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

બેંકની નોન પરફોર્મિંગ એસેટ્સની પરિસ્થિતિ :

તા. ૩૧-૩-૨૦૨૩ ના રોજ બેંકનું એન.પી.એ. રૂ. ૧૮,૫૭,૮૩,૪૨૦.૭૧ હતું જે કુલ ધિરાણના ૧.૪૦% જેટલું હતું.

તા. ૩૧-૩-૨૦૨૪ ના રોજ બેંકનું એન.પી.એ. રૂ. ૧૬,૦૪,૦૭,૮૫૪.૮૨ થયેલ હતું જે કુલ ધિરાણના ૧.૦૪% જેટલું થાય છે. બેંકનું નેટ એન.પી.એ. ૦.૦૦% છે.

ચાલુ વર્ષે બેંકની વિવિધ ધ્રાન્યના દેવાદારોના જુદા જુદા ૩ ખાતાઓ મળીને કુલ રૂ. ૬,૮૦,૪૪૦/- (રૂપિયા છ લાખ એસી હજાર ચાર સો પુરા) ઘણાં પ્રયત્નો કરવા છતાં વસુલ કરી શક્યા નથી. ઉપરાંત મૂળ દેવાદાર તથા તેમના ગેરંટર પાસેથી બેંકને તારણમાં આપેલ મિલકતોમાંથી સંપૂર્ણ વસુલાત શક્ય ન હોવાથી આ દેવાદારની રકમ હાલ પુરતી માંડી વાળવામાં આવે છે. આમ છતાં આ દેવાદાર પર વસુલાતની કાયદેસરની પ્રક્રિયા સતત ચાલુ જ રહેશે. બીજાં પણ કેટલાંક જૂના NPA ખાતાઓમાં SARFAESI કાયદા મુજબની રીકવરીની પ્રક્રિયા ચાલુ છે અને આવનાર વર્ષોમાં તે પરત મળવાની સંભાવના છે.

રિઝર્વ બેંક દ્વારા લાગુ કરવામાં આવેલ આવક માન્યતા તથા મિલકત લેણાંના વર્ગીકરણના ધોરણોનું બેંક દ્વારા ચુસ્તપણે પાલન કરવામાં આવે છે તથા એન.પી.એ. સામે પચાસિ જોગવાઈ કરી બેંકના હિસાબો સંપૂર્ણ પારદર્શક તથા બેંકની સાચી પરિસ્થિતિનું પ્રતિબિંબ પડે તે રીતે રાખવામાં આવે છે.

થાપણ :

વર્ષ દરમિયાન, “નૂતન સમૃદ્ધિ થાપણ” યોજના દ્વારા રૂ. ૩૩૮.૦૦ કરોડની થાપણો થાપણદારો દ્વારા બેંકમાં મુકવામાં આવેલ હતી. જે થાપણદારોનો બેંક પ્રત્યેનો વિશ્વાસ પ્રતિબિંબિત કરે છે. બેંકની શાખને કારણે તથા ગ્રાહકોમાં બેંક પ્રત્યેના સાથ સહકાર અને વિશ્વાસના કારણે થાપણોમાં સતત વધારો થઈ રહ્યો છે.

ધિરાણ :

તા. ૩૧-૦૩-૨૦૨૪ ના રોજ બેંકનું કુલ ધિરાણ વધીને રૂ. ૧૫૧૩.૩૫ કરોડ થયેલ છે. જે ગત વર્ષે તા. ૩૧-૦૩-૨૦૨૩ના રોજ ૧૩૨૭.૫૯ કરોડ હતું.

સરેરાશ ધિરાણનો દર વર્ષ ૨૦૨૩-૨૪ ના દરમિયાન ૮% રહેલ છે જે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૮.૨૪% હતો.

વર્ષ દરમિયાન ધિરાણની વૃદ્ધિને વેગ આપવા બેંક દ્વારા આકર્ષક દરે ધિરાણની અનેક યોજનાઓ રજૂ કરવામાં આવી હતી. જેવી કે....

(૧) કોમર્શીયલ ઈક્વીપમેન્ટ/વ્હીકલ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ) લોન યોજના

(૨) કોમર્શીયલ પેસેન્જર વ્હીકલ લોન યોજના

(૩) સોલાર પ્લાન્ટ માટે ધિરાણ (ઈન્ડસ્ટ્રીના પોતાના ઉપયોગ માટે)

(૪) કાર લોન (ફિક્સ વ્યાજ દરે)

(૫) નૂતન ઈઝી રાઈડર લોન યોજના (દ્વીચક્રી વાહનો માટે)

ઉપરોક્ત ધિરાણ યોજનાઓમાં બેંક દ્વારા રૂ. ૧૨૩.૦૦ કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવેલ હતું.

હાઉસિંગ ધિરાણ મર્યાદામાં વધારો :

રિઝર્વ બેંક દ્વારા વ્યક્તિગત હાઉસિંગ ધિરાણ મર્યાદામાં સુધારો કરવામાં આવેલ છે. જે અંતર્ગત આપણી બેંકની લિમિટ રૂ. ૭૦.૦૦ લાખથી વધીને

રૂ. ૧૪૦.૦૦ લાખ થયેલ છે.

ભંડોળના રોકાણો :

રિઝર્વ બેંક / નાબાર્ડ તથા સહકાર ખાતાની વખતો વખત જાહેર થતી માર્ગદર્શક સૂચનાઓને ચુસ્તપણે અનુસરીને આપણી બેંક તેના ભંડોળનું ખૂબ વ્યવહાર અને નિયમબદ્ધ રોકાણ માટે આયોજન કરતી રહી છે.

બેંકીંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈ પ્રમાણે સરકારી તથા અન્ય માન્ય ટ્રસ્ટી જામીનગીરીઓમાં ભંડોળો રોકવાના રહે છે.

કાયદાની જોગવાઈ અનુસાર કરવાનાં થતાં ફરજિયાત રોકાણો કર્યા પછી તેમજ ધિરાણો અંગેના કાર્યક્રમો, કબુલાતોમાં ભંડોળોની ફાળવણી કર્યા પછી બેંક પાસે ફાજલ રહેલા ભંડોળોનું ભારત સરકાર / રાજ્ય સરકારની તથા અન્ય માન્ય ટ્રસ્ટી જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવે છે. રોકાણો ઉપર મહત્તમ વ્યાજ વળતર મળી રહે તે માટે વિવિધ પ્રકારે રોકાણ કરવામાં આવે છે.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

બોર્ડ ઓફ મેનેજમેન્ટ :

રિઝર્વ બેંકની માર્ગદર્શિકા મુજબ આપણી બેંકે બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરેલ છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કુલ ૬ સભ્યો પૈકી ત્રણ સભ્યોની બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી તથા ત્રણ સભ્યો (જે તે ક્ષેત્રના નિષ્ણાંતો) ની નિમણૂક કરવામાં આવેલ છે. જેઓના નામ નીચે મુજબ છે. (૧) શ્રી આનંદભાઈ શરદચંદ્ર પટેલ-ચેરમેન-બોર્ડ ઓફ મેનેજમેન્ટ (બિઝનેસમેન) (૨) શ્રી માલવભાઈ મહેન્દ્રભાઈ ફડીયા (બિઝનેસમેન) (૩) શ્રી રાહીલભાઈ નિમેષભાઈ શાહ (બિઝનેસમેન તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) (૪) શ્રી ચીનુભાઈ નાથાલાલ શાહ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) (૫) શ્રી ઉમેશચંદ્ર કનૈયાલાલ ત્રિવેદી (રિટાયર્ડ ડી.જી.એમ.-બેંક ઓફ ઈન્ડિયા) (૬) શ્રી ચંપકલાલ મોહનલાલ શાહ (રિટાયર્ડ એ.જી.એમ.-બેંક ઓફ બરોડા). બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે, તે બદલ હું બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું. તા. ૩૧-૩-૨૦૨૪ના રોજ પૂરા થતા વર્ષ દરમિયાન બોર્ડ ઓફ મેનેજમેન્ટની કુલ ૧૫ મીટીંગ યોજાયેલ હતી.

CBS Software અને Cyber Security

આપણી બેંકમાં તા. ૦૧-૦૪-૨૦૦૮ થી CBS સેવા શરૂ થઈ ગયેલ છે તથા બેંકના ખાતેદારોને ABB (એની બ્રાન્ચ બેંકીંગ) સેવા તથા RTGS/NEFT સેવા વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે. ટેકનોલોજીમાં થતા સતત ફેરફાર તથા બેંકીંગ સેક્ટરમાં આવી રહેલ નવી-નવી ટેકનોલોજીનો લાભ બેંક દ્વારા ગ્રાહકોને પહોંચાડવામાં આવે છે. ગત વર્ષ દરમિયાન દેશની કેટલીક મોટી કો. ઓ. બેંકોના CBS Software માં હેકીંગ કરી ઘણાં મોટા પ્રમાણમાં નાણાંકીય ઉચાપત થવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આપણી બેંકે સાયબર સિક્યોરીટી માટેની પોલીસી બનાવી અને તે મુજબ સાયબર સિક્યોરીટી વધુ સઘન અને સુદૃઢ બનાવવામાં આવેલ છે.

૨૪x૭ Online Payment Facility

બેંકના ખાતેદારોને આપણી બેંક દ્વારા ૨૪x૭ ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપવામાં આવે છે. બેંકના ખાતેદારોને Online બેંકીંગમાં પડતી તકલીફો નિવારવા બેંક દ્વારા ૨૪x૭ હેલ્પ લાઈન નંબર ૦૭૯-૨૬૪૪૪૪૪૧ તથા ૧૮૦૦૨૩૩૩૭૩૭ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

ઈન્ટરનેટ બેંકીંગ / મોબાઈલ બેંકીંગ સેવાઓ :

આપણી બેંક દ્વારા ઈન્ટરનેટ બેંકીંગ સેવા શરૂ કરવામાં આવેલ છે. ગ્રાહકોની સેવામાં બેંક દ્વારા મોબાઈલ બેંકીંગ સેવા શરૂ કરવામાં આવેલ છે. આ સેવા હેઠળ ફંડ ટ્રાન્સફર (NEFT, Interbank Transfer, IMPS), મીની સ્ટેટમેન્ટ, બેલેન્સ પૂછપરછ, ચેક બુક ઈન્ડેન્ટ, ચેકનું સ્ટેટસ જાણવા જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. આપણી બેંકના સર્વે ગ્રાહકોને વિનંતી છે કે આ અંગે જરૂરી એક્ટીવેશન ફોર્મ ભરીને આ સેવાનો મહત્તમ લાભ લે. બેંકના ડિમેટ ખાતેદારો પોતાની ઓફિસ-રહેઠાણથી પોતાના ડિમેટ ખાતાના સ્ટેટમેન્ટ ઈન્ટરનેટ દ્વારા જોઈ શકે છે. તેમજ તેનું પ્રીન્ટીંગ પણ લઈ શકે છે. આ અંગે ખાતા ધારકે બેંકમાં જરૂરી અરજી કરવાની રહેશે.

વોટ્સએપ બેંકીંગ :

બેંક દ્વારા વોટ્સએપ બેંકીંગ પણ શરૂ કરવામાં આવેલ છે. જે દ્વારા બેંકના ગ્રાહકોને (૧) બેલેન્સ ઈન્ક્વાઈરી (૨) મીની સ્ટેટમેન્ટ (૩) ડેબીટ કાર્ડ બ્લોક/અનબ્લોક કરવા (૪) ડિમેટ હોલ્ડીંગ (૫) આઈપીઓ ડિટેલ્સ જેવી સુવિધાઓ ઝડપથી મળી શકે છે. વધુમાં વોટ્સએપ બેંકીંગ દ્વારા ગ્રાહકોને બેંકની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવે છે તથા અગત્યની સૂચનાઓ પણ મોકલવામાં આવે છે.

ડેબિટ કમ એ.ટી.એમ. કાર્ડ (Rupay) અને ઈ-કોમર્સ સેવા :

આપણી બેંક દ્વારા ગ્રાહકોને નિ:શુલ્ક Debit cum ATM Card (Rupay) ઈસ્યુ કરવામાં આવે છે. આ કાર્ડ ભારતભરની લગભગ તમામ બેંકોના એટીએમ કેન્દ્રો પર તેમજ પોઈન્ટ ઓફ સેલ પર સ્વીકૃત છે. બેંકની ઈ-કોમર્સ સેવા હેઠળ બેંકના ડેબિટ કમ એટીએમ કાર્ડથી ઓનલાઈન શોપીંગની સુવિધા ઉપલબ્ધ છે. આ સેવાઓનો ગ્રાહકો મહત્તમ લાભ લે.

TUF Scheme (Technology Up-gradation Fund) :

આ સ્કીમમાં ટેક્નાઈલ તથા અન્ય ઉદ્યોગ માટે ઈન્ટરનેટ / કેપીટલ સબસીડી માટે બેંકને માન્યતા મળેલ છે.

પેરા બેંકીંગ સુવિધાઓ :

બેંકીંગ ક્ષેત્રે વર્તમાન સમય તીવ્ર હરિફાઈનો છે, આથી બેંકો માટે નફાનું વ્યાજબી સ્તર જાળવી રાખવા, કોર બેંકીંગ ઉપરાંત ઘણી બધી પેરા બેંકીંગ પ્રવૃત્તિઓ અને સેવાઓ આપવી આવશ્યક બની ગયેલ છે. જેથી એમાંથી મળતી આવકમાંથી બેંકનો વહીવટી ખર્ચ નીકળી શકે. પેરા બેંકીંગ પ્રવૃત્તિઓ અને સેવાઓ વધવાથી બેંકના ગ્રાહક વર્ગમાં પણ વધારો થયેલ છે. આપણી બેંક નીચે મુજબની પેરા બેંકીંગ સેવાઓ આપે છે.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

(૧) સેઈફ ડિપોઝીટ વોલ્ડ (લોકર) સુવિધા :

આપણી બેંક દ્વારા ગ્રાહકોને ઉત્કૃષ્ટ લોકર સેવા આપવામાં આવે છે. બેંકની શાખાઓમાં શક્ય એટલી જગ્યામાં વધુને વધુ લોકર્સ મુકવાનું આયોજન કરીએ છીએ, જેથી ગ્રાહકોની માંગને સંતોષી શકાય. બેંકની **વાસણા, ડ્રાઈવ-ઇન રોડ (મેમનગર), પાંજરાપોળ, જોધપુર-સેટેલાઈટ, લૉ-ગાર્ડન, ઈસનપુર, નારણપુરા, નારાયણનગર રોડ, નવા શારદા મંદિર રોડ, વેજલપુર, થલતેજ, મણિનગર, ઓટવ અને બોપલ શાખાઓ દ્વારા સેઈફ ડિપોઝીટ વોલ્ડ (લોકર) સુવિધા આપવામાં આવે છે.**

(૨) ડિમેટ સેવા :

આપણી બેંક દ્વારા સને ૨૦૦૦ થી ગ્રાહકોને ડિમેટ સેવા અપાય છે. ડિમેટ સેવા લૉ-ગાર્ડન ઉપરાંત બેંકની મસ્કતી માર્કેટ, ન્યૂ કલોથ માર્કેટ, આશ્રમ રોડ, રખિયાલ, બાપુનગર, ડ્રાઈવ-ઇન રોડ, પાંજરાપોળ, જોધપુર-સેટેલાઈટ, ઈસનપુર, નારણપુરા, નવા શારદા મંદિર રોડ, વેજલપુર, થલતેજ અને અંધેરી (મુંબઈ) શાખાઓ દ્વારા પણ આપવામાં આવે છે.

બેંકના ડિમેટ ખાતેદારો ઓનલાઈન ડીલીવરી ઈન્સ્ટ્રક્શન (માર્કેટ) આપી શકે તે માટે Speed-e ની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે શાખાનો સંપર્ક કરવા વિનંતી છે.

(૩) ASBA સુવિધા :

આપણી બેંકની ASBA (Application Supported by Blocked Amount) સુવિધા હેઠળ શેર્સ માટે અરજીઓ સ્વીકારવાની SEBI તરફથી મંજૂરી મળી હોવાથી બેંકના ખાતેદારોને IPO/FPO માં અરજી કરવામાં સુગમતા થયેલ છે. ASBA ની સુવિધા બેંકની દરેક શાખા દ્વારા આપવામાં આવે છે. ગ્રાહકો ઈન્ટરનેટ બેંકીંગનો ઉપયોગ કરીને Online ASBA Application કરી શકે છે.

(૪) ઈ-સ્ટેમ્પીંગ/સ્ટેમ્પ ફ્રેન્કીંગ સેવા :

બેંકની મસ્કતી માર્કેટ, રખિયાલ, વાસણા, ડ્રાઈવ-ઇન, જોધપુર-સેટેલાઈટ અને ન્યૂ શારદા મંદિર શાખાઓ દ્વારા ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ રૂ. ૧૦,૦૦૦/- સુધીની રકમનું સ્ટેમ્પ ફ્રેન્કીંગ કરી આપવામાં આવે છે. વધુમાં બેંક દ્વારા રખિયાલ, શાંતિ કોમર્શિયલ અને લૉ-ગાર્ડન શાખામાં ઈ-સ્ટેમ્પીંગની સુવિધા ઉપલબ્ધ છે. જેનો લાભ બેંકના ખાતેદારો, સભાસદો અને શહેરીજનો લઈ રહ્યા છે.

(૫) વીમા યોજના :

આપણી બેંકના બચત ખાતા ધારકોને વીમા કવચ મળી રહે તે માટે બેંકે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે LIC સાથે તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ સાથે MOU કરેલ છે. બચત ખાતા ધારકોને આ બંને યોજનાનો લાભ લેવા વિનંતી. વધુ માહિતી માટે આપની નજીકની શાખાનો સંપર્ક કરવા વિનંતી.

(૬) અટલ પેન્શન યોજના

આપણી બેંક દ્વારા ભારત સરકાર પ્રાયોજિત અટલ પેન્શન યોજના ચાલુ કરવામાં આવેલ છે. ૧૮ થી ૪૦ વર્ષની ઉંમર સુધીના તમામ ભારતીય નાગરિક આ યોજનામાં જોડાઈ શકે છે. આ યોજનામાં જોડાનાર વ્યક્તિ તેના દ્વારા આ યોજનામાં આપેલ યોગદાનના આધારે રૂ. ૧૦૦૦ થી રૂ. ૫૦૦૦ સુધીનું માસિક પેન્શન ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થયેથી આજીવન મેળવી શકે છે તથા ત્યારબાદ હયાત વારસદારોને આ યોજનામાં જમા થયેલ કુલ ભંડોળ વ્યાજ સાથે પરત મળવાપાત્ર છે. વધુ વિગત માટે ગ્રાહકો બેંકની નજીકની શાખાનો સંપર્ક કરે અને આ સેવાઓનો મહત્તમ લાભ લે.

(૭) Bill Desk સેવા

આપણી બેંકના ગ્રાહકો તેમના વિવિધ સેવાકીય બીલનું Online Payment કરી શકે તે માટે Bill Desk સાથે કરાર કરવામાં આવેલ છે. બેંકના ગ્રાહકો Bill Desk ની સુવિધાનો ઉપયોગ ઈન્ટરનેટ બેંકીંગ તથા મોબાઈલ બેંકીંગ દ્વારા કરી શકે છે.

(૮) UPI Service Activation

આપણી બેંકના ગ્રાહકો તેમના વિવિધ સેવાકીય બીલનું Online Payment કરી શકે તે માટે UPI Service Activation માટે કરાર કરવામાં આવેલ છે. આ સેવા દ્વારા ગ્રાહકો પોતાના મોબાઈલ વડે વિવિધ બિલોની ઓનલાઈન ચુકવણી કરી શકે છે તથા ઈ-કોમર્સ સેવાનો લાભ પણ લઈ શકે છે. વધુ વિગત માટે ગ્રાહકો બેંકની નજીકની શાખાનો સંપર્ક કરે અને આ સેવાઓનો મહત્તમ લાભ લે.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

KYC નોર્મ્સ ના પાલન અંગે તથા CKYC અંગે :

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન્સ તથા ફાયનાન્શીયલ ઈન્ટેલીજન્સ યુનિટ (એફ.આઈ.યુ.) ઈન્ડિયાના વખતોવખતના પરિપત્રો અન્વયે ખાતેદારોના વ્યવહારોની માહિતી અંગેના પત્રકો નિયત સમયમર્યાદામાં મોકલવાના હોય છે. બેંક સાથે જોડાયેલ સભાસદો, ખાતેદારો, ગ્રાહકો બેંક સાથે નિયમિત વ્યવહારો કરે, સક્રિય રહે તે જરૂરી છે. જેથી તેઓના ખાતા ડોરમેન્ટ (નિષ્ક્રિય) ન થાય અને ખાતાઓ સક્રિય કરવા અગવડતા ન પડે તે હેતુથી બેંકની શાખા દ્વારા KYC ગાઈડલાઈન્સના પાલન અંગે સમયાંતરે જરૂરી KYC ડોક્યુમેન્ટ ખાતેદારો પાસેથી મંગાવવામાં આવે ત્યારે KYC ડોક્યુમેન્ટ આપી સાથ-સહકાર આપશો. બેંકના કસ્ટમરના CKYC રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં પણ આપને સહકાર આપવા વિનંતી. બેંક દ્વારા RBI ના વખતોવખત જારી થતા વિવિધ સરકારી નિયંત્રણોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.

કમિટીઓ :

બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઓડિટ, ઈન્વેસ્ટમેન્ટ, એસેટ્સ લાયાબીલીટી મેનેજમેન્ટ, I.T., બોર્ડ ઓફ મેનેજમેન્ટ, સ્પેશયલ કમિટી ઓફ બોર્ડ ફોર મોનીટરીંગ ફોડ તથા રીકવરી માટે કમિટીઓ નિયુક્ત કરી છે. જે નિયમિત રીતે મળી છે.

ઓડિટ અને ઈન્સ્પેક્શન :

આપણી બેંકની ૯ શાખાઓનું કન્કરન્ટ ઓડિટ કરાવવામાં આવે છે. ઉપરાંત બેંકની બધીજ શાખાઓનું ઈન્ટરનલ ઈન્સ્પેક્શન પણ કરવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સુચના પ્રમાણે ઓડિટ કમિટીની રચના કરવામાં આવી છે. કન્કરન્ટ ઓડિટર્સ/ઈન્ટરનલ ઈન્સ્પેક્શનના તેમજ સ્ટેચ્યુટરી ઓડિટર્સે કરેલાં અવલોકનોને અમલમાં મુકવા માટે અને બેંકની કાર્યક્ષમતા સુધારવા માટે ઓડિટ કમિટી કાર્યરત રહે છે. આમ બેંકના સંચાલનને ક્ષતિરહિત બનાવવાના આશયથી કન્કરન્ટ ઓડિટ તથા સ્ટેચ્યુટરી ઓડિટની કામગીરીને સંકલિત કરવામાં આવી છે. બદલાતા સંજોગોને અનુલક્ષીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વધુને વધુ પ્રમાણમાં નીતિ વિષયક અને વહીવટી કડક નિયંત્રણો લદાઈ રહ્યાં છે, જે આવકારદાયક છે. RBI ની માર્ગદર્શિકા મુજબ, આપણી બેંકે જોખમ આધારિત આંતરિક ઓડિટ સિસ્ટમ (Risk Based Internal Audit-RBIA) દાખલ કરી છે. આનાથી આપણું ઓડિટ સંપૂર્ણપણે જોખમ કેન્દ્રિત રહેશે અને વિવિધ ક્ષેત્રોમાં રહેલ જોખમોનું વધુ ઝીણવટથી મૂલ્યાંકન થઈ શકશે.

બેંક સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમ :

બેંકના કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તથા બેંકિંગ ક્ષેત્રે થતા ફેરફારોની જાણકારી મળી રહે તે માટે સમયાંતરે તાલીમ કાર્યક્રમ યોજી તેમાં જુદા-જુદા વિષયના નિષ્ણાતોને બોલાવી જાણકારી આપવામાં આવે છે, જેનાથી કર્મચારીઓમાં નિયત લક્ષ્યાંકો સિધ્ધ કરવા માટે હકારાત્મક વલણ જોવા મળેલ છે. આ તાલીમ કાર્યક્રમોમાં બેંકના ચેરમેનશ્રી, ડિરેક્ટર્સશ્રી, અધિકારીશ્રીઓ પણ હાજર રહી માર્ગદર્શન આપે છે.

બેંકના કર્મચારીઓના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થાય તેમજ બેંકિંગ વિષયના સઘન અભ્યાસ માટે બેંક JAIIB/CAIIBની પરીક્ષા આપવા તેઓને પ્રોત્સાહિત કરે છે. તેમાં ઉત્તીર્ણ થયેલા કર્મચારીઓને પ્રમોશન ઝડપથી મળે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (CAB), પૂના ખાતે વિવિધ વિષયો પર યોજાતી ટ્રેઈનિંગમાં પણ કર્મચારીઓને બેંક દ્વારા મોકલવામાં આવે છે. બેંકની સેન્ટ્રલ ઓફિસથી પણ બેંકિંગના વિવિધ વિષયોને આવરી લેતી ટ્રેઈનિંગ આપવામાં આવે છે. તેમજ કર્મચારીઓ માટે બેંકિંગ સેમીનાર AMA સાથે વારંવાર ગોઠવવામાં આવે છે.

આભાર દર્શન :

બેંકના કામકાજમાં અન્ય બેંકો, સહકારી મિત્રો ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, રાજ્ય સરકારશ્રી, જીલ્લા રજીસ્ટ્રારશ્રી, સ્ટેટ રજીસ્ટ્રારશ્રી તથા સેન્ટ્રલ રજીસ્ટ્રારશ્રી-ન્યુ દિલ્હી તરફથી મળેલ સહકાર માટે સર્વેનો આભાર માનું છું.

અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને અતિ વ્યસ્ત હોવા છતાં પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી વાર્ષિક ચેરમેન શ્રી આનંદભાઈ શરદચંદ્ર પટેલ તેમજ અન્ય ડિરેક્ટર સાહેબો તથા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીનાં સભ્યો માનદ્ સેવા આપે છે. તેઓશ્રી તરફથી બેંક સંચાલનમાં અમૂલ્ય માર્ગદર્શન મળેલ છે. સૌનો અત્રે આભાર માનું છું.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

બેંકના સફળ સંચાલન માટે જનરલ મેનેજર **શ્રી અશોક કાપડીયા** નો હું આ ક્ષણે આભાર માનું છું. આ ઉપરાંત બેંકના બધાજ અધિકારીગણ તેમજ તમામ કર્મચારીઓએ ખંત, વફાદારીપૂર્વક અને સંતોષકારક કામગીરી બજાવી છે તે બદલ તેમને ધન્યવાદ આપું છું. યુનિયનના હોદ્દાઓ તેમજ સર્વ કર્મચારીગણ સાથેના સંબંધો ખૂબજ સુમેળભર્યા રહેવાથી બેંકનો ખૂબજ સુંદર વિકાસ થયો છે. તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.

આપણી બેંકની ઉત્તરોત્તર થતી વિકાસયાત્રામાં બેંકના પૂર્વ ચેરમેનશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ તથા અન્ય શુભચિંતકોએ આપેલ અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેઓ પ્રત્યે આદરભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. બેંકની વિકાસયાત્રામાં સકારાત્મક પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા બદલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના મારા સાથી મિત્રો, માનવંતા સભાસદો, ગ્રાહકો અને શુભેચ્છકોએ મુકેલ અતૂટ વિશ્વાસના પરિણામે જ બેંકે વિકાસનાં સોપાનો સર કરેલ છે, જેઓનો પણ આભાર માનું છું.

બેંકના થાપણદારશ્રીઓએ બેંકના વહીવટમાં વિશ્વાસ વ્યક્ત કરી તેઓની બચતો આપણી બેંકમાં થાપણ તરીકે મૂકેલ છે તે બદલ તેમનો આભારી છું. બેંકની વિકાસયાત્રામાં તેમજ બેંકના ગ્રાહકલક્ષી અભિગમમાં વિશ્વસનીયતા વ્યક્ત કરી સહકારી ક્ષેત્રને સબળ બનાવવાની કામગીરીમાં બેંકને પ્રત્યક્ષ-પરોક્ષ સહકાર આપનાર તમામનો હું ઋણી છું અને તેમનો આભાર માનું છું.

આપના તરફથી અત્યાર સુધી મળેલ અમૂલ્ય સાથ અને સહકાર આવનાર વર્ષોમાં પણ મળી રહેશે તેવી આશા સાથે વિરમું છું.

ભદ્રં ભદ્રં પિતર ભગવન્ ભૂયસે મંગલાય ॥

“હે ઈશ્વર, અમને સર્વેના કલ્યાણ માટે ઉત્તમ તત્વ આપો”

આપનો આભાર,

અમદાવાદ.

તા. ૧૨/૦૬/૨૦૨૪

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી,

ધનાભાઈ ચીમનલાલ શાહ

ચેરમેન



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

INDEPENDENT AUDITORS REPORT

To,
The Members,
Nutan Nagarik Sahakari Bank Ltd.

REPORT ON FINANCIAL STATEMENTS

Opinion :-

1. We have audited the accompanying financial statements of Nutan Nagarik Sahakari Bank Ltd ("the Bank") as at 31 March 2024, which comprise the Balance Sheet as at 31 March 2024, the Profit and Loss Account, and the Cash Flow Statement for the year then ended, and a summary of significant accounting policies and other explanatory information.
2. In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid financial statements together with the Notes thereon give the information required by the Banking Regulation Act, 1949, the Multi State Co-operative Societies Act, 2002 and the Multi State Co-operative Societies Rules, 2002 and guidelines issued by Reserve Bank of India and the Central Registrar of Cooperative Societies ("the Acts"), in the manner so required and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India of the state of affairs of the Bank as at March 31, 2024 and its profit and its Cash Flows for the financial year ended on that date.

Basis for Opinion :-

3. We conducted our audit in accordance with the Standards on Auditing (SAs) issued by Institute of Chartered Accountants of India. Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the Financial Statements section of our report. We are independent of the Bank in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India together with ethical requirements that are relevant to our audit of the financial statements under the provisions of the Banking Regulations Act, 1949 and the rules made thereunder and under the provisions of the Multi State Co-operative Societies Act, 2002 and the rules made thereunder, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the Code of Ethics. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our opinion.

Management's Responsibility for the Financial Statements :-

4. The Bank's Board of Directors are responsible for preparation of these financial statements that give a true and fair view of the financial position, financial performance and cash flows of the Bank in accordance with the accounting principles generally accepted in India, including the Accounting Standards issued by ICAI, provisions of Banking Regulation Act, 1949 and the Rules made thereunder, provisions of Multi State Cooperative Societies Act, 2002 and the Rules made thereunder and circulars and guidelines issued by RBI from time to time. This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Acts for safeguarding the assets of the Bank and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

In preparing the financial statements, management is responsible for assessing the Bank's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Bank or to cease operations, or has no realistic alternative but to do so.

The Board of Directors is also responsible for overseeing Bank's Financial Reporting progress.



Auditors' Responsibility for the audit of the financial statements :-

5. Our objectives are to obtain reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with Standards on Auditing will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these financial statements.

As part of an audit in accordance with Standards on Auditing, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

- Identify and assess the risks of material misstatement of the financial statements, whether due to fraud or error, design and perform audit procedures responsive to those risks, and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.
- Obtain an understanding of internal controls relevant to the audit in order to design procedures that are appropriate in the circumstances but not for the purpose of expressing an opinion on the effectiveness of the entity's internal control.
- Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by the management.
- Conclude on the appropriateness of management's use of going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Bank's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Bank to cease to continue as a going concern.
- Evaluate the overall presentation, structure and content of the financial statements, including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

Report on Other Legal & Regulatory Requirements :-

6. The Balance Sheet and the Profit and Loss Account have been drawn up in Forms "A" and "B" respectively of the Third Schedule to the Banking Regulation Act, 1949, The Multi State Co-operative Societies Act, 2002, and the Multi State Co-operative Societies Rules, 2002.
7. As required by Section 73(4) of the Multi State Co-operative Societies Act, 2002, we report that:
- a. We have obtained all the information and explanations, which to the best of our knowledge and belief were necessary for the purpose of our audit and have found to be satisfactory;
 - b. In our opinion, proper books of account as required by law have been kept by the Bank so far as it appears from our examination of those books and proper returns adequate for the purposes of our audit have been received from the branches/offices;
 - c. The transactions of the Bank which came to our notice have been within the powers of the Bank;



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

- d. The Balance Sheet, the Profit and Loss Account and the Cash Flow statement dealt with by this report are in agreement with the books of account and the returns;
- e. The accounting standards adopted by the Bank are consistent with those laid down by accounting principles generally accepted in India so far as applicable to Banks;
- f. In our opinion and according to information and explanations given to us, we have not noticed any material impropriety or irregularity in the expenditure or in the realization of money due to the bank.
8. As per the information and explanations given to us and based on our examination of the books of account and other records, we report as under on the matters specified in clause (a) to (f) of Rule 27(3) of the Multi State Co-operative Societies Rules, 2002:
 - a. We have not come across any transactions which appear to be contrary to the provisions of the Multi-State Co-operative Societies Act, 2002, the rules or the bye-laws of the Bank.
 - b. We have not come across any material or significant transactions which appear to be contrary to the guidelines issued by the Reserve Bank of India.
 - c. Money belonging to the Bank which appears to be bad or doubtful of recovery as on 31st March, 2024 was Rs. 16,04,07,854.92 in respect of advances classified as NPA and/or as Doubtful and Loss Assets as per prudential norms issued by RBI. There are no money bad or doubtful of recovery in respect of other assets. Adequate provision has been made for the same as per extant RBI guidelines.
 - d. As per the information given to us and to the best of our knowledge, the Bank has not given loans to the members of the Board of Directors, except as permitted by the Acts.
 - e. We have not observed any violation of guidelines, conditions etc., issued by the Reserve Bank of India.
 - f. There are no matters that have been specified by the Central Registrar of Cooperative Societies in this regard.

For Jain Kedia and Sharma,
Chartered Accountants
Firm Registration No.: 103920W

CA Ramesh Kedia
Partner
Membership No. 035997
UDIN : 24035997BKHDSA3099

Place: Ahmedabad
Date : 12/06/2024



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

Balance Sheet as at 31st March 2024

31-3-2023	Capital & Liabilities	31-3-2024
₹		₹
	(1) Capital	
30,00,00,000	1. Authorised Capital	30,00,00,000
	120,00,000 shares each of ₹ 25/-	
	2. Subscribed Capital	
24,40,85,075	95,76,824 shares each of ₹ 25/- (Previous Year 97,63,403 Shares each of ₹ 25/-)	23,94,20,600
	3. Amount called upon	
	95,76,824 Shares each of ₹ 25/- of (2) above, held by	23,94,20,600
	(Previous Year 97,63,403 Shares each of ₹ 25/-)	
	(a) Individual (24,083 Members) (Previous Year 23,369 Members)	
	(b) No. of Shares Issued During year (3,26,879 Shares) (Previous Year 5,15,585 Shares)	
	(c) No. of Shares Redeemed During year (5,13,458 Shares) (Previous Year 6,48,565 Shares)	
-----	(d) Co. op. Institution	-----
-----	(e) State Government	-----
24,40,85,075		23,94,20,600
	(2) Reserve And Other Funds	
75,72,82,762	i. Statutory Reserve	79,11,62,314
32,19,82,588	ii. Building Fund	28,72,32,589
5,36,90,066	iii. Bad & Doubtful Debts Reserve	5,36,90,066
21,71,23,772	iv. Bad & Doubtful Debts Reserve (Section - 36)	23,16,70,968
11,24,36,300	v. Investment Fluctuation Reserve	15,34,36,300
16,77,65,740	vi. Investment Depreciation Reserve	12,41,89,351
1,63,02,81,228		1,64,13,81,588
24,40,85,075	Total C/F	23,94,20,600



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

Balance Sheet as at 31st March 2024

31-3-2023	Property & Assets	31-3-2024
₹		₹
11,25,53,510	(1) Cash on Hand	10,65,44,645
	(2) Balance in Current Account with	
1,45,24,94,085	Reserve Bank of India	2,18,60,11,903
1,31,27,020	State Bank of India	18,71,077
42,49,505	State Co. op. Bank	1,73,384
8,98,200	Central Co. op. Bank	1,02,000
1,47,07,68,810		2,18,81,58,364
	(3) Balance with Other Banks	
28,06,69,105	(i) Current Deposits	23,60,10,426
-----	(ii) Savings Bank Deposits	-----
87,75,42,136	(iii) Fixed Deposits (Including State Co. op. & Central Co op. Banks)	1,82,70,07,113
1,15,82,11,241		2,06,30,17,539
	(4) Money at Call & Short Notice	
-----	Call Money	-----
-----	CROMS (Clearcorp Repo Order Matching System)	-----
-----	TREPS Lending	-----
-----	LAF Reverse Repo	-----
	(5) Investments (At Book Value)	
6,95,12,76,026	(A) (a) In Central & State Govt. Securities	67,60,799,986
65,21,22,455	(b) Govt. Secu. under TREPS lien Unutilized	84,61,55,341
-----	(c) Govt. Secu. under TREPS lien Utilized	-----
9,92,22,500	(d) Govt. Secu. Depo. To CCIL Margin	9,86,65,000
7,70,26,20,981		7,70,56,20,327
	Face Value ₹ 7,75,00,00,000	
	Market Value ₹ 7,38,71,20,150	
-----	(B) Other Approved Securities	-----
	(C) Share in Co. op. Institution (At Book Value)	
10,000	(a) State Co. op. Bank	10,000
17,50,000	(b) Central Co. op. Bank	17,50,000
-----	(c) Other Societies	-----
17,60,000		17,60,000
16,27,09,500	(D) Other Investments (Bond-Non SLR)	18,12,72,000
7,86,70,90,481		7,88,86,52,327
10,60,86,24,042	Total C/F	12,24,63,72,875



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

Balance Sheet as at 31st March 2024

31-3-2023	Capital & Liabilities	31-3-2024
₹		₹
24,40,85,075	Total B/F	23,94,20,600
1,63,02,81,228	Total B/F	1,64,13,81,588
	vii. Other Funds	
72,41,223	(a) Co-Op. Propaganda Fund	72,41,223
1,38,43,570	(b) Member Incentive Fund	1,78,43,570
6,28,69,434	(c) Provision for Standard Assets	7,28,69,434
12,88,17,550	(d) Unforeseen Losses Reserve	14,23,55,567
39,81,961	(e) Co. Op. Education Fund (Members/Employees)	40,81,961
4,05,00,000	(f) Sp. Reserve for Long Term Finance Sec. 36 (1) (viii)	5,55,00,000
73,01,79,565	(g) Revaluation Reserve	68,50,84,829
35,00,000	(h) Cyber Security Fund	1,00,00,000
12,50,000	(i) Dharmada Fund	12,50,000
2,62,24,64,531		2,63,76,08,172
	(3) Principal/ Subsidiary State/ Partnership Fund Account	
	For Share Capital of :	
-----	i Central Co. Op. Bank	-----
-----	ii Primary Agriculture Credit Society	-----
-----	iii Other Societies	-----
2,86,65,49,606	Total C/F	2,87,70,28,772



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

Balance Sheet as at 31st March 2024

31-3-2023	Property & Assets	31-3-2024
₹	₹	₹
10,60,86,24,042	Total B/F	12,24,63,72,875
	(6) Advances	
6,11,62,34,804	i Short Term Loans, Cash Credit, Overdrafts & Bills Discounted of which secured Against	6,50,48,52,895
	(a) Govt. & Other Approved Securities 14,82,16,434	
	(b) Other Tangible Securities 6,34,47,63,436	
	Of the Advances Amount Due From Individuals 6,50,48,52,895	
	(c) Of the Advances Amount Overdue 13,09,32,371	
	Considered Bad & Doubtful of recovery 8,07,13,495	
2,18,43,30,395	ii. Medium Term Loans of which Secured Against	2,55,52,59,634
	(a) Govt. & Other Approved Securities 27,764	
	(b) Other Tangible Securities 2,50,77,84,037	
	Of the Advances Amount Due From Individuals 2,55,52,59,634	
	(c) Of the Advances Amount Overdue 3,56,05,300	
	Considered Bad & Doubtful of recovery 1,00,07,947	
4,97,53,39,995	iii. Long Term Loans of which Secured Against	6,07,34,67,018
	(a) Govt. & Other Approved Securities -----	
	(b) Other Tangible Securities 6,03,98,46,204	
	Of the Advances Amount Due From Individuals 6,07,34,67,018	
	(c) Of the Advances Amount Overdue 16,89,49,492	
	Considered Bad & Doubtful of recovery 6,27,82,590	
13,27,59,05,194		15,13,35,79,547
23,88,45,29,236	Total C/F	27,37,99,52,422



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

Balance Sheet as at 31st March 2024

31-3-2023	Capital & Liabilities	31-3-2024
₹		₹
2,86,65,49,606	Total B/F	2,87,70,28,772
	(4) Deposits & Other Accounts	
	i. Term Deposits	
15,62,16,94,711	(a) Individuals	17,74,85,09,171
-----	(b) Central Co. Op. Banks	-----
23,67,39,943	(c) Other Societies	25,84,13,333
<u>15,85,84,34,654</u>		<u>18,00,69,22,504</u>
	ii. Savings Bank Deposits	
4,46,98,72,599	(a) Individuals	5,26,70,40,643
-----	(b) Central Co. Op. Banks	-----
91,40,842	(c) Other Societies	1,40,14,380
<u>4,47,90,13,441</u>		<u>5,28,10,55,023</u>
	iii. Current Deposits	
1,70,92,23,566	(a) Individuals	2,00,30,72,884
-----	(b) Central Co. Op. Banks	-----
1,46,00,923	(c) Other Societies	1,55,78,369
<u>1,72,38,24,489</u>		<u>2,01,86,51,253</u>
-----	iv. Money at call and Short Notices	-----
<u>22,06,12,72,584</u>		<u>25,30,66,28,780</u>
	(5) Borrowings	
-----	i. From the Reserve Bank Of India/State/ Central Co.op. Bank	-----
-----	(a) Short Term Loans, Cash Credit & Overdraft of which Secured Agst.	-----
-----	(A) Govt. & Other Approved Securities	-----
-----	(B) Other Tangible Securities (Against Fixed Deposit)	-----
-----	(b) Medium-Term Loans of which Secured Agst.	-----
-----	(A) Govt. & Other Approved Securities	-----
-----	(B) Other Tangible Securities	-----
<u>24,92,78,22,190</u>	Total C/F	<u>28,18,36,57,552</u>



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

Balance Sheet as at 31st March 2024

31-3-2023	Property & Assets	31-3-2024
₹		₹
23,88,45,29,236	Total B/F	27,37,99,52,422
20,70,31,036	(7) Interest Receivable	25,39,56,518
	Interest receivable on advances of which Overdue of which considered Bad & Doubtful of recovery	4,74,70,319 4,74,70,319
3,98,044	(8) Bills For Receivable	62,250
	being Bills for collection as per contra	-----
14,86,011	(9) Branch Adjustment	34,83,436
	(10) Land & Premises	
59,88,10,042	Balance	88,43,13,113
32,17,93,979	Add : Addition during this year	-----
92,06,04,021		88,43,13,113
-----	Less : Sales/Written Off	-----
3,62,90,908	Less : Depreciation	5,21,47,131
88,43,13,113		83,21,65,982
	(11) Furniture & Fixtures	
4,38,15,148	Balance	3,35,69,830
14,70,807	Add. : Purchase/ Trnf	9,85,092
4,52,85,955		3,45,54,922
41,802	Less : Sales/ Written Off /Trnf	1,07,217
1,16,74,323	Less : Depreciation	71,44,970
3,35,69,830		2,73,02,735
	(12) Office Equipments	
4,00,40,461	Balance	3,38,94,414
66,66,143	Add. : Purchase / Trnf	5,95,795
4,67,06,604		3,44,90,209
2,84,484	Less : Sales/ Written Off / Trnf	7,455
1,25,27,706	Less : Depreciation	77,08,540
3,38,94,414		2,67,74,214
25,04,52,21,684	Total C/F	28,52,36,97,557



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

Balance Sheet as at 31st March 2024

31-3-2023	Capital & Liabilities	31-3-2024
₹		₹
24,92,78,22,190	Total B/F	28,18,36,57,552
	(c) Long Term Loans of which Secured Agst.	
	---- (A) Govt. & Other Approved Securities	----
	---- (B) Other Tangible Securities	----
--J--	ii. From State Bank of India	----
	(a) Short Term Loans, Cash Credit & Overdraft of which Secured Agst.	
	---- (A) Govt. & Other Approved Securities	----
	---- (B) Other Tangible Securities	----
	(b) Medium-Term Loans of which Secured Agst.	
	---- (A) Govt. & Other Approved Securities	----
	---- (B) Other Tangible Securities	----
	(c) Long Term Loans of which Secured Agst.	
	---- (A) Govt. & Other Approved Securities	----
	---- (B) Other Tangible Securities	----
	iii. From State Govt.	
	(a) Short Term Loans of which Secured Agst.	
	---- (A) Govt. & Other Approved Securities	----
	---- (B) Other Tangible Securities	----
	(b) Medium-Term Loans of which Secured Agst.	
	---- (A) Govt. & Other Approved Securities	----
	---- (B) Other Tangible Securities	----
	(c) Long Term Loans of which Secured Agst.	
	---- (A) Govt. & Other Approved Securities	----
	---- (B) Other Tangible Securities	----
24,92,78,22,190	Total C/F	28,18,36,57,552



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

Balance Sheet as at 31st March 2024

31-3-2023	Property & Assets	31-3-2024
₹		₹
25,04,52,21,684	Total B/F	28,52,36,97,557
	(13) Computer Systems	
1,02,00,130	Balance	67,06,172
61,11,490	Add. : Purchase / Trnf	1,39,70,941
1,63,11,620		2,06,77,113
10	Less : Sales/ Written Off / Trnf	11
96,05,438	Less : Depreciation	91,89,929
67,06,172		1,14,87,173
	(14) Banks Vehicle	
16,99,603	Balance	8,38,745
-----	Add. : Purchase / Trnf	-----
16,99,603		8,38,745
-----	Less : Sales/ Written Off / Trnf.	32,689
8,60,858	Less : Depreciation	3,27,642
8,38,745		4,78,414
		4,78,414
25,05,27,66,601	Total C/F	28,53,56,63,144



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

Balance Sheet as at 31st March 2024

31-3-2023	Capital & Liabilities	31-3-2024
₹		₹
24,92,78,22,190	Total B/F	28,18,36,57,552
-----	iv Loans from other sources	-----
	Borrowing under TREPS (Agst. Govt. Securities)	
3,98,044	(6) Bills For Collection	62,250
	being Bills receivable as per contra entry	
-----	(7) Branch Adjustment	-----
4,64,49,399	(8) Overdue Interest Reserve	4,74,70,319
25,06,770	(9) Interest Payable	17,61,032
	(10) Other Liabilities	
5,93,74,138	1. Bills Payable	2,48,82,567
13,60,541	2. Unclaimed Dividend	22,94,453
53,00,605	3. Sundry Liabilities (Deferred Tax Liability)	58,30,000
4,43,60,548	4. Income Received in Advance	4,83,42,177
9,17,94,026	5. Sundry Creditors	3,75,48,132
16,96,371	6. HDFC DD Contra	5,75,385
19,88,18,141	7. Others	5,08,10,002
40,27,04,370		17,02,82,716
	(11) Profit & Loss A/c.	
12,80,32,087	Profit As Per Last Balance Sheet	13,53,80,171
12,80,32,087	Less : Appropriation	13,53,80,171
13,53,80,171	Add : Profit for the Year	18,42,30,116
	(12) Contingent Liabilities	
	1. Outstanding Liabilities for Guarantee Issued 20,57,60,766 (Previous Year ₹ 16,69,52,425)	
	2. Other Foreign / Inland L. C. Issued 3,25,36,500 (Previous Year ₹ 2,07,20,690)	
	3. DEAF (Unclaimed Deposit) payable 5,92,85,939 (Previous Year ₹ 5,81,11,628)	
	4. Claims not acknowledged as debt 1,34,56,176 (Previous Year ₹ 94,57,000)	
25,51,52,60,944	Total	28,58,74,63,985

As per our Audit Report of even date

For, M/s. Jain Kedia & Sharma
Chartered Accountants
(Firm Registration No: 103920W)

(Ramesh Kedia)
Partner
M. No. 035997

Ashok Kapadia
General Manager &
Chief Executive Officer

Place : Ahmedabad
Date : 12/06/2024



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

Balance Sheet as at 31st March 2024

31-3-2023

Property & Assets

31-3-2024

₹

₹

₹

25,05,27,66,601

Total B/F

28,53,56,63,144

(15) Other Assets B/F

51,01,072

a. Tax paid in Advance / Tax Deducted at Source

41,75,58,767

b. Stationery and Stamps

81,81,567

1,98,17,100

c. Deposit - Security & Collateral

1,98,17,100

1,83,21,033

d. Other Assets

2,32,26,789

16,96,371

e. HDFC DD Contra

5,75,385

46,24,94,343

5,18,00,841

5,18,00,841

----- (16) Assets acquired under claim

25,51,52,60,944

Total

28,58,74,63,985

Dhanabhai Chimanlal Shah
Chairman

Place : Ahmedabad
Date : 12/06/2024

Anandbhai Sharadchandra Patel
Vice Chairman



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

Profit & Loss Account for the year ended 31st March 2024

31-3-2023	Expenditure	31-3-2024
₹	₹	₹
1,09,37,05,731	1. Interest on Deposits & Borrowing	1,44,26,13,536
29,68,16,226	2. Salaries, Allowances & Provident Fund (including Bonus/Ex-gratia)	27,96,45,949
20,000	3. Directors Fees	2,90,000
1,77,94,074	4. Rent, Taxes, Insurance, Lighting etc.	1,72,81,895
1,73,003	5. Law Charges	31,43,618
48,88,906	6. Postage, Telegrams & Telephone Charges	43,90,624
4,85,250	7. Audit Fee	12,88,250
4,30,19,791	8. Depreciation	3,14,23,476
90,97,538	9. Repairs & Maintenance	1,00,17,571
52,13,923	10. Stationery & Printing	49,64,610
31,98,551	11. Advertisement	9,81,176
2,66,72,298	12. Insurance	3,02,39,490
1,20,072	13. (a) Loss on Sale of Assets & Written off	1,14,681
1,33,63,750	(b) Short Term Capital Loss on Investment	19,97,500
-----	(c) Long Term Capital Loss on Investment	61,74,000
1,34,83,822		82,86,181
	14. Other Expenditures	
99,25,251	(a) GST Expenses	1,06,23,414
2,54,58,764	(b) DSA Commission (Marketing)	57,33,696
4,25,000	(c) Donation	91,000
3,68,50,189	(d) All Other Expenses	3,25,61,952
7,26,59,204		4,90,10,062
	15. Provisions and Contingencies	
50,00,000	(a) Provision for Standard Assets	1,00,00,000
7,54,91,738	(b) Provision for Investment Depreciation Reserve	-----
1,00,00,000	(c) Special Reserve for Long Term Finance	1,50,00,000
2,00,00,000	(d) Provision for Bad and Doubtful Debt Reserve	1,50,00,000
	Fund	
26,88,347	(e) Amortization of Premium in Govt. Security	23,95,653
11,31,80,085		4,23,95,653
	16. Income Tax	
4,60,00,000	(a) Provision for Income Tax	3,35,00,000
1,30,166	(b) Income Tax Account	13,00,000
12,30,000	(c) Deferred Tax	5,29,395
4,73,60,166		3,53,29,395
7,16,18,530	Profit before exceptional items	14,43,54,004
	Exceptional items	
8,11,328	prior period expense	1,23,888
7,08,07,202	Profit for the year	14,42,30,116
1,81,93,87,098		2,10,56,55,490
13,53,80,171	Profit transferred to Balance Sheet	18,42,30,116
13,53,80,171	Total	18,42,30,116



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)
Ahmedabad

Profit & Loss Account for the year ended 31st March 2024

31-3-2023	Income	31-3-2024
₹		₹
1,59,85,96,491	1. Interest & Discount	1,93,78,17,109
1,30,10,807	2. Commission, Exchange & Brokerage	2,22,59,984
12,58,41,306	3. Income from Sale of Special Adhesive Stamp	1,37,32,128
3,00,57,841	4. Rent on Safe Deposit Lockers	3,19,38,438
7,219	5. Profit on Sale of Assets	37,039
1,37,59,426	6. Short Term Capital Gain on Investment	1,72,69,684
55,15,000	7. Long Term Capital Gain on Investment	----
1,58,69,766	8. Other Receipts	2,14,88,819
61,94,850	9. Excess Provision of Income Tax Brought Back	98,24,549
76,17,718	10. Recovery of Bad debts	48,69,000
29,16,674	11. Interest & Income Tax Refund	28,42,351
----	12. Investment Depreciation reserve brought back	4,35,76,389
1,81,93,87,098		2,10,56,55,490
7,08,07,202	Profit for the year	14,42,30,116
	Add : Reserve fund brought back to Profit & Loss account	
----	(a) Building fund brought back	4,00,00,000
6,45,72,969	(b) Excess Investment Fluctuation Reserve brought back	----
13,53,80,171	Total	18,42,30,116

As per our Audit Report of even date

For, M/s. Jain Kedia & Sharma

Chartered Accountants

(Firm Registration No: 103920W)

Dhanabhai Chimanlal Shah

Chairman

(Ramesh Kedia)

Partner

M. No. 035997

Ashok Kapadia
**General Manager &
Chief Executive Officer**

Anandbhai Sharadchandra Patel

Vice Chairman

Place : Ahmedabad

Date : 12/06/2024



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

ACCOUNTING POLICIES AND NOTES FORMING PART OF THE ACCOUNTS FOR THE YEAR ENDED 31st MARCH, 2024

[A] **SIGNIFICANT ACCOUNTING POLICIES:**

(1) **BASIS OF PREPARATION:**

The financial statements have been prepared and presented under the historical cost convention on the accrual basis of accounting, unless otherwise stated and comply with generally accepted accounting principles, statutory requirements prescribed under the Banking Regulation Act, 1949 and the Multi State Co-operative Societies Act, 2002, circulars and guidelines issued by the Reserve Bank of India (RBI) from time to time, the Accounting Standards (AS) issued by the Institute of Chartered Accountants of India (ICAI) and current practices prevailing within the banking industry in India.

(2) **USE OF ESTIMATES:**

The preparation of the financial statements, in conformity with generally accepted accounting principles, requires Management to make estimates and assumptions that affect the reported amounts of assets and liabilities, revenues and expenses and disclosure of contingent liabilities at the date of the financial statements. Actual results could differ from those estimates. Management believes that the estimates used in the preparation of the financial statements are prudent and reasonable. Any revision to the accounting estimates is recognized prospectively.

(3) **CHANGES IN ACCOUNTING POLICIES:**

Changes in accounting policies are made if warranted by regulatory framework, law, or is in interest of fair and better presentation. Such changes are disclosed appropriately in the year in which such changes are made and impact of such changes are also disclosed as required by regulatory framework and accounting standards.

(4) **PROPERTY PLANT & EQUIPMENT AND DEPRECIATION**

4.1 Fixed Asset are stated at cost less accumulated depreciation as adjusted for impairment, if any .Cost includes cost of purchase and all expenditure like site preparation, installation cost and professional fees incurred on the asset before it is ready to use. Subsequent expenditure incurred on asset put to use is capitalised only when it increases future benefit/functioning capability. The Bank follows the revaluation framework of accounting in respect of Land & Building. These assets are stated at their revalued amount and difference between carrying cost and the revalued amount is credited to revaluation reserve. Revaluation of Land & Building owned by bank is done at interval of every three years. Revaluation frequency, revaluation practice and the methodology followed by the bank are in conformity with the framework prescribed under the RBI Circular No. DOR.CAP.REC.No.86/ 09.18.201/2022-23 dated December 01, 2022 read with RBI circular No. DOR.CRE.REC.No.17/13.5.000/2022-23 dated April 08, 2022 and Circular No. DOR.CAP.REC. No.109/09.18.201/2022-23 dated March 28, 2023. Last Revaluation of Land & Building was done as on 31.03.2023

4.2. Depreciation is charged in accordance with the Accounting Standard 10-“Property, Plant and Equipment” based on written down value method at rates determined based on the estimated pending useful life of the assets mentioned in the paragraph 4.3

The Management believes that the useful life of assets assessed by the bank taking into account changes in technology, the utility and efficiency of asset in use fairly reflects its estimate of useful lives of the fixed assets.

4.3 Estimates of useful Life of various categories of Assets and per the method of depreciation followed is as under

Type of Asset	Estimated Useful Life (Years)	Rates of Depreciation
Building (RCC)	60	Rates of Depreciation for providing depreciation on written down value method are derived separately in respect of each of the assets based on the respective assets’ remaining useful life, in a manner that the unamortised carrying cost of the asset is amortised over its remaining useful life.
Furniture	15	
Electrical Equipment & installation	10	
Office Equipment	8	
Elevator/Lift	10	
Safe Deposit Vault	30	
Vehicle	8	

4.4 Depreciation on revalued portion of the carrying cost of Land & Buildings is charged to revaluation reserve account.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

4.5 Depreciation on fixed assets purchased during the year is charged for the entire year, if the asset is purchased and retained for 180 days or more, otherwise it is charged at 50% of the normal rate. No depreciation is charged on assets sold during the year.

4.6 Depreciation on Information Technology Equipment including Computer Systems and Peripherals, etc. is charged as per straight line method at the rate of 33.33 % as directed by RBI guidelines. In view of extant RBI guidelines, full depreciation is provided on such assets irrespective of date of purchase.

(5) INVESTMENTS:

5.1 Categorization of investments:

In accordance with guidelines issued by RBI, the Bank classifies its investment portfolio into the following three categories:

- i) 'Held to Maturity' - Securities acquired by the Bank with the intention to hold till maturity.
- ii) 'Held for Trading' - Securities acquired by the Bank with the intention to trade.
- iii) 'Available for Sale' – Securities which do not fall within the above two categories are classified as 'Available for Sale'.

5.2 Classification of Investments:

As required under the Banking Regulation Act, 1949 and RBI guidelines, for the purpose of disclosure in the Balance Sheet, Investments are classified as follows: – Government Securities, Other approved Securities, Shares in co-operative institutions, Debentures and Bonds, Subsidiaries and / or Joint Ventures and other Investments.

5.3 Valuation of Investments:

- (i) **'Held to Maturity'** – These investments are carried at their acquisition cost less amortization on any premium paid on acquisition of such investments.
- (ii) **'Held for Trading'** – The individual scrip in the HFT category is marked to market at monthly intervals.
- (iii) **'Available for Sale'** – The individual scrip in the AFS category is marked to market at the year end.
- (iv) The net resultant depreciation in respect of "Held for Trading" and "Available for Sale" Investments is recognized in the Profit and Loss Account in respect of each of the classification mentioned in Para 5.2 above. Net appreciation, if any, is ignored.
- (v) Market value of Government Securities (excluding Treasury Bills) is determined based on the price list published by RBI or the prices periodically declared by FBIL for valuation at year-end. In case of unquoted Government Securities, market price or fair value is determined as per the rates published by FBIL.
- (vi) Treasury Bills are valued at carrying cost.
- (vii) Units of Mutual Funds are valued at the lower of cost and net asset value provided by the respective Mutual Fund.
- (viii) Broken period interest on debt instruments paid at time of acquisition is excluded from the cost of such instrument.
- (ix) Non performing investments are identified and classified as per applicable RBI guidelines.

5.4 Shifting of Investments:

Shifting of investment from one category to another is done in conformity with guidelines issued by RBI from time to time. Shifting of Investments from one category to another under all circumstances are done at the Acquisition cost or book value or market value on the date of transfer, whichever is the least. Depreciation, if any, on such transfer is provided for and net appreciation, if any is ignored.

5.5 Accounting for Repo / Reverse Repo transactions (including transactions under the liquidity Adjustment Facility (LAF) with the RBI)

The securities sold and purchased under Repo/ Reverse Repo are accounted as Collateralized Borrowing and Lending transactions. However, securities are transferred as in the case of normal outright sale/ purchase transactions and such movement of securities is reflected using the Repo/ Reverse Repo accounts and contra entries. The above entries are reversed on the date of maturity. Interest charged on repo transaction and received on reverse repo transaction is charged to Profit & loss account as the case may be. Balance in Repo account is classified under "Borrowings" and balance in Reverse Repo account is classified under "Money at Call & Short Notice".

(6) ADVANCES:

6.1 The bank follows system of classification as prescribed by Reserve bank of india in respect of all its advances which includes classification based on security such as secured and unsecured, sectoral classification of advances such as priority and non priority and performing and non performing. Non-Performing assets are further classified into Sub-standard, Doubtful and Loss Asset.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

- 6.2 The Bank follows Income Recognition and Asset Classification (IRAC) norms prescribed by RBI from time to time, according to which provision on advances is made as follows.

Sr No	Performing Assets	Particulars	Rate of Provision
I	Standard Assets	Direct advances to Agri. & SME sector	0.25
		Commercial Real Estate	1.00
		Commercial Real Estate – Residential House	1.00
		All other loans & advances	0.40
		Restructured Advances – Covid -19	20.00
II		Sub Standard Advances	10.00
	Non-Performing Assets	Doubtful Advances	
		Unsecured Portion	100.00
		Secured Portion	
		Up to 1 year	20.00
		1-3 Years	30.00
		Above 3 Years	100.00
		Loss Asset	Unsecured Portion
			100.00

- 6.3 Advances are stated at gross value without netting off the provisions. Provision made in respect of advances are classified as under

- Reserve created by appropriation of Profit & loss Account as per the by-laws of the bank is credited separately to Bad & Doubtful Debt Reserve and disclosed separately under the head Reserves and Other Funds in the Balance Sheet.
- Provision made in respect of NPA as per RBI IRAC Norms and additional provision made over and above the provision in respect of NPA and provision made as per provisions of section 36 (1) (vii) of income tax act, 1961 are debited to Profit & Loss Account and credited to Bad & Doubtful Debt Reserve Fund (Sec 36) shown under the head Reserves and Other Funds in the Balance Sheet.
- Provision made in respect of standard accounts as per RBI IRAC Norms is debited to Profit & Loss Account and credited as Provision for Standard Asset and is disclosed in Reserve and Other Funds under the sub head Other Funds.

- 6.4 Overdue Interest on NPAs is credited to "Overdue Interest Reserve" account as per directives of RBI.

- 6.5 Amounts realized/recovered in case of NPA are first adjusted against outstanding principal amount.

(7) REVENUE RECOGNITION :

- 7.01 The revenues are accounted for on accrual basis except Insurance claims, Dividends, PMJJBY and PMSBY Commission, Incentive from NSDL, NPCI which are accounted on cash basis as information to estimate the same with reasonable accuracy on accrual basis is not available with bank.

- 7.02 Interest on advances classified as NPA is accounted for on realization basis.

- 7.03 Arrears of locker rent at the end of the year is recognized as income on receipt basis in accordance with principle of prudence.

- 7.04 Commission of full quarter is credited to Profit & Loss account in respect of all bank guarantee issued during such quarter.

(8) EXPENSES:

Provision for interest on matured and overdue deposits has been made as per directives of Reserve Bank of India w.e.f. 01/09/2008.

(9) TAXATION:

Current income tax is measured at the amount expected to be paid to the Tax Authorities in accordance with the applicable provisions under the Income Tax Act, 1961.

Deferred Tax assets and liabilities are recognized, subject to consideration of prudence, on timing difference, representing the difference between taxable income and accounting income that originated in one period and is capable of reversal in one or more subsequent periods. Deferred Tax Assets and Liabilities are measured using tax rates and tax laws that have been enacted or substantially enacted by the Balance Sheet date. Deferred tax assets are recognized and re-assessed at each reporting date, based upon the Management's judgment as to whether realization is considered as reasonably certain.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

(10) **PROVISIONS, CONTINGENT LIABILITIES AND CONTINGENT ASSETS:**

Provision

A provision is recognised when the Bank has a present obligation as a result of past event where it is probable that an outflow of resources will be required to settle the obligation, in respect of which a reliable estimate can be made. Provisions are not discounted to its present value and are determined based on best estimate required to settle the obligation at the Balance Sheet date. These are reviewed at each Balance Sheet date and adjusted to reflect the current best estimates. When there is a possible or present obligation in respect of which the likelihood of outflow of resources is remote, no provision or disclosure is made.

Contingent Assets

Contingent Assets are not recognised in the financial statements. However, contingent assets are assessed continually and if it is virtually certain that an inflow of economic benefits will arise, the asset and related income are recognised in the period in which the change occurs.

Contingent Liabilities

Contingent Liabilities are disclosed when there is a possible obligation arising from a past event, the existence of which will be confirmed by occurrence or non-occurrence of one or more uncertain future events not within the control of the Bank or any present obligation arising from past event which is not recognized since it is not probable that an outflow of resources will be required to settle the obligation or a reliable estimate of the amount of such obligation cannot be made.

(11) **IMPAIRMENT OF ASSETS:**

The bank assesses at each balance sheet date whether there is any indication that an asset may be impaired. Impairment loss, if any, is provided in the Profit and Loss Account to the extent the carrying amounts of assets exceed their estimated recoverable amount. Since the Bank has ascertained that there is no material impairment of any of its assets, no provision on account of impairment of assets is required to be made.

(12) **EMPLOYEE BENEFITS:**

Gratuity:

The Bank provides for gratuity payable to all employees. The benefit vests upon completion of five years of service and is in the form of lump sum payment to employees on resignation, retirement, death while in employment or on termination of employment, an amount equivalent to 15 days salary plus eligible allowances payable for each completed year of service, as per the Payment of Gratuity Act, 1972. The Bank makes contributions to funds administered and managed by the LIC of India. The defined gratuity benefit plans are valued by LIC as at the Balance Sheet date using the projected unit credit method as per the requirement of AS-15 "Employee Benefits", to determine the present value of the defined benefit obligation and the related service costs. Under this method, the determination is based on actuarial calculation which includes assumptions about Mortality rate, Attrition Rate, Discount Rate, Salary Escalation and Expected return on Plan Assets.

Provident fund:

In accordance with law, all the employees of the Bank are entitled to receive benefits under the provident fund. Every employee contributes an amount, on a monthly basis, at a determined rate. The Bank contributes the amount as prescribed by law. Contribution made by bank is expensed and charge to profit & loss account as part of employee benefits.

Leave Encashment:

In respect of leave encashment liability, the Bank has obtained Insurance Policies with LIC which covers the liability towards leave encashment of the bank till the age of 60. The shortfall, if any, between projected benefit obligation and the fair value of plan assets as on 31st March is provided for and recognized as expense in the Profit and Loss Account.

In respect of employees above 60 years who are not covered by the insurance policy taken with LIC the bank is making provision based on the estimated liability on gross basis without discounting the same for its present value. Such liability is not represented by corresponding plan assets and the payment as and when made is met out of the normal cash flow of the bank.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

(13) EVENTS OCCURRING AFTER BALANCE SHEET DATE

Material Adjusting events occurring after balance sheet date are recognized in financial statements. Non-adjusting events occurring after balance sheet date that represents material change affecting the financial position are disclosed in reports of Board of Directors.

[B] NOTES FORMING PART OF ACCOUNTS:-

(1) The bank is registered under Section 9 of Multi-State Co-op. Societies Act, 1984 vide registration Number MSCS/CR/114/2000 dated 13/11/2000. A copy of certificate of Registration to above has been forwarded by the Central Registrar, New Delhi, to the Registrar of Co. Op. Societies, Gujarat State at Gandhinagar. As per the provisions of sec. 18(5) of Multi State Co. Operative Societies Act, 1984, registration certificate under Gujarat state Co. Op. societies Act 1961, has been returned to registrar of Co. Op. Society Gujarat State. The Bank is registered under the Multi-State Co.Op.Society Act and rules framed there under. Bank shall provide @ 1% of the Net Profit for the liability towards Education Fund to be paid to National Co.Op.Union of India Limited, under Multi-State Co-op. Societies Rules 2002.

(2) Previous year's figures are regrouped wherever necessary.

(3) Items of Income and expenditure of same nature are shown at gross value at respective income and expenditure side.

(4) Amounts disclosed herein as advances to individuals also includes advances to institutions, partnership firms and corporates as per prevailing practise followed by co- operative banks.

(5) a) Advances & Gross NPAs:

	Standard	Non Performing				Total
	Total Standard Advances	Sub-standard	Doubtful	Loss	Total Non-Performing Advances	(000's omitted)
Gross Standard Advances and NPAs						
Opening Balance	1,30,90,122	3,033	1,21,560	61,190	1,85,783	1,32,75,905
Add: Additions during the year	18,83,051				21,435	19,04,486
Less: Reductions during the year	-				46,811	46,811
Closing balance	1,49,73,173	6,903	1,16,369	37,135	1,60,407	1,51,33,580
Reductions in Gross NPAs due to:						
Up gradation		10,914	-	-	10,914	10,914
Recoveries (excluding recoveries from upgraded accounts)		4,896	5,190	25,358	35,444	35,444
Write-offs		-	-	453	453	453
Provisions (excluding Floating Provisions) (Required)						
Opening balance of provisions held	60,198	303	1,07,765	61,190	1,69,258	2,29,456
Add: Fresh provisions made during the year	7,958	387	-	-	387	8,345
Less: Excess provision reversed/ Write-off loans	-	-	1,583	24,055	25,638	25,638
Closing balance of provisions held	68,156	690	1,06,182	37,135	1,44,007	2,12,163
Net NPAs						
Opening Balance		-	-	-	-	
Add: Fresh additions during the year		-	-	-	-	
Less: Reductions during the year		-	-	-	-	
Closing Balance	-	-	-	-	-	-
Floating Provisions						
Opening Balance	1,01,045	-	-	-	-	1,04,226
Add: Additional provisions made during the year	3,188	-	-	-	-	41,840
Less: Amount drawn down during the year	-	-	-	-	-	-
Closing balance of floating provisions	1,04,226	-	-	-	-	1,46,066

Ratios	31.03.2024	31.03.2023
Gross NPA to Gross Advances	1.06%	1.40%
Net NPA to Net Advances	-	-
Provision coverage ratio	177.90%	145.77%



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

b) Sector-wise Advances and Gross NPAs-

(000's omitted)

Sr No	Sector	Current Year 2023-24			Previous Year 2022-23		
		Outstanding Total Advances	Gross NPAs	Percentage of Gross NPAs to Total Advances in that sector	Outstanding Total Advances	Gross NPAs	Percentage of Gross NPAs to Total Advances in that sector
i)	Priority Sector						
a)	Agriculture and allied activities	8,651	-	-	1,135	-	-
b)	Advances to industries sector eligible as priority sector lending	70,40,300	17,097	0.24	65,93,293	19,037	0.29
c)	Services	15,61,933	-	-	11,99,598	-	-
d)	Personal loans	6,37,674	162	0.03	5,77,561	611	0.11
	Subtotal (i)	92,48,558	17,259	0.19	83,71,587	19,648	0.23
ii)	Non-priority Sector						
a)	Agriculture and allied activities	-	-	-	-	-	-
b)	Industry	17,65,891	1,22,427	6.93	17,49,743	142,521	8.14
c)	Services	1,60,774	14,461	8.99	1,79,705	19,328	10.75
d)	Personal loans	39,58,357	6,260	0.16	29,74,867	4,285	0.14
	Sub-total (ii)	58,85,022	1,43,148	2.43	49,04,316	1,66,135	3.38
	Total (I + ii)	1,51,33,580	1,60,407	1.06	1,32,75,903	1,85,783	1.40
Sub Sector where outstanding advances exceeds 10% of the outstanding total advances to respective sector							
	Particulars	Outstanding Total Advances	Gross NPAs	Percentage of Gross NPAs to Total Advances in that sector	Outstanding Total Advances	Gross NPAs	Percentage of Gross NPAs to Total Advances in that sector
Agriculture & allied activities							
	Engineering						
	Priority	1,045	-	-	1,135	-	-
	Non Priority	-	-	-	-	-	-
	Others- Misc						
	Priority	7,022	-	-	-	-	-
	Non Priority	-	-	-	-	-	-
Industry							
	Construction						
	Priority	2,75,507	-	-	104,938	-	-
	Non Priority	8,08,557	-	-	8,81,464	997	0.11
	Plastic						
	Priority	11,45,665	396	0.03	9,71,863	144	0.01
	Non Priority	23,171	-	-	11,441	-	-



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

Iron & Stainless Steel							
Priority	15,67,900	-	-	15,26,233	-	-	-
Non Priority	1,17,374	45,450	38.72	1,39,869	45,586	32.59	
Textile							
Priority	13,77,849	-	-	14,06,478	139	0.01	
Non Priority	1,87,399	8,278	4.42	2,15,236	8,478	3.93	
Services							
Medical							
PRIORITY	14,08,497	-	-	11,43,402	-	-	-
NON PRIORITY	1,41,623	14,461	10.21	1,58,314	19,173	12.11	
Personal loans							
Others- Misc							
Priority	5,55,748	162	0.03	5,13,654	611	0.12	
Non Priority	29,26,112	6,086	0.21	23,02,563	4,052	0.17	

The information with regards to agriculture, services, industries and personal sector is derived from the classification adopted by bank in respect of various category of advance

c) Particulars of resolution plan and restructuring

Bank has not restructured any account during the year.

d) Details of financial assets sold to Asset Reconstruction Companies

Bank has not sold any accounts to asset reconstruction companies.

e) Details of non-performing financial assets purchased/sold from/to other banks/Financial Institutions/NBFCs (excluding ARCs)

Bank has not sold or purchased non performing financial assets to or from other banks/financial institution/NBFC.

Bank has also not transferred or acquired any loan as outlined in RBI circular No : DOR.STR.REC.51/21.04.048/2021-22 dated September 24,2021

f) Fraud Accounts

Bank has reported following frauds to RBI During the year.

(000's omitted)

Particulars	2023-24	2022-23
Number of Frauds Reported	-	1
Amount Involved in Fraud	-	17,569
Amount of Provision made for such frauds	-	17,569
Amount of Un amortised Provision from other reserves as at the end of the year.	-	-

Till date bank has recovered Rs 4,415 thousand (Rs 4,360 thousand towards principal and Rs 55 thousand towards interest) from the borrower whose accounts were reported as fraud account in FY 2022-23.

At present outstanding Principle amount is Rs 13,208 thousand against which security of Rs 8,136 thousand is available with bank. Bank has made 100% provision as per IRAC Norms which is included in Bad and Doubtful debt Reserve.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

g) Disclosure under Resolution Framework for Covid 19-related stress Asset (000's omitted)

Exposure to accounts classified as Standard consequent to implementation of resolution plan

Type of borrower	Position as at the end of the previous Half year (A)	Of (A), aggregate debt that slipped into NPA during the Half year	Of (A) amount written off during the Half year	Of (A) amount paid by the borrowers during the Half year	Position as at the end of Half year
Personal Loans	-	-	-	-	-
Corporate persons	-	-	-	-	-
Of which MSMEs	-	-	-	-	-
Others Apr –Sep	11,581	-	-	506	11,075
Oct - Mar	11,075	-	-	1,573	9,502
Total	11,581	-	-	2,079	9,502

6) INVESTMENTS:

Investments in Central Government Securities, State Government Securities and other approved SLR Securities are as per the norms of Reserve Bank of India.

Classification of Investments: - The entire Investment portfolio of the Bank has been classified in accordance with RBI guidelines as under:

Investment in India as at 31.03.2024

(000's omitted)

	Government Securities	Other Approved Securities	Shares	Debentures and Bonds	Subsidiaries and Joint Ventures	Others	Total Investments in India
Held to Maturity							
Gross	45,11,877	-	1,760	-	-	-	45,13,637
Less: Provision for non-performing investments	-	-	-	-	-	-	-
Net	45,11,877	-	1,760	-	-	-	45,13,637
Available for Sale							
Gross	31,93,743	-	-	1,81,272	-	-	33,75,015
Less: Provision for depreciation and NPI	1,24,189	-	-	-	-	-	1,24,189
Net	30,69,554	-	-	1,81,272	-	-	32,50,826
Held for Trading							
Gross	-	-	-	-	-	-	-
Less: Provision for depreciation and NPI	-	-	-	-	-	-	-
Net	-	-	-	-	-	-	-
Total Investments	77,05,620	-	1,760	1,81,272	-	-	78,88,652
Less: Provision for non-performing investments	-	-	-	-	-	-	-
Less: Provision for depreciation and NPI	1,24,189	-	-	-	-	-	1,24,189
Net	75,81,431	-	1,760	1,81,272	-	-	77,64,463



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

Investment In India as at 31.03.2023

(000'omitted)

	Government Securities	Other Approved Securities	Shares	Debentures and Bonds	Subsidiaries and Joint Ventures	Others	Total Investments in India
Held to Maturity							
Gross	49,62,362	-	1,760	-	-	-	49,64,122
Less: Provision for non-performing investments	-	-	-	-	-	-	-
Net	49,62,362	-	1,760	-	-	-	49,64,122
Available for Sale							
Gross	27,40,259	-	-	1,62,710	-	-	29,02,969
Less: Provision for depreciation and NPI	1,67,766	-	-	-	-	-	1,67,766
Net	25,72,493	-	-	1,62,710	-	-	27,35,203
Held for Trading							
Gross	-	-	-	-	-	-	-
Less: Provision for depreciation and NPI	-	-	-	-	-	-	-
Net	-	-	-	-	-	-	-
Total Investments	77,02,621	-	1,760	1,62,710	-	-	78,67,091
Less: Provision for non-performing investments	-	-	-	-	-	-	-
Less: Provision for depreciation and NPI	1,67,766	-	-	-	-	-	1,67,766
Net	75,34,855	-	1,760	1,62,710	-	-	76,99,325

Movement of Provisions for Depreciation and Investment Fluctuation Reserve

(000's omitted)

	Particulars	31.03.2024	31.03.2023
I)	Movement of Provisions held towards depreciation on Investments		
	a) Opening Balance	1,67,766	1,29,713
	b) Add : Provisions made during the year	14,554	75,492
	c) Less :Adjusted towards book value of HTM Investment	-	37,439
	d) Less : Excess Provision Brought Back	58,131	-
	e) Closing Balance	1,24,189	1,67,766
II)	Movement of Investment Fluctuation Reserve		



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

	a) Opening Balance	1,12,436	1,52,509
	b) Add : Amount transferred during the year (Appropriation)	41,000	24,500
	c) Less : Drawdown	-	64,573
	d) Closing Balance	1,53,436	1,12,436
III)	Closing Balance in IFR as a percentage of closing balance of investments in AFS and HFT/Current Category	4.55	3.87

Non-SLR Investment Portfolio

(000's omitted)

I)	Non-Performing Non-SLR Investments		
Sr.No.	Particulars	31.03.2024	31.03.2023
a)	Opening Balance	-	-
b)	Additions during the year since 1st April	-	-
c)	Reductions during the above period	-	-
d)	Closing Balance	-	-
e)	Total Provisions held	-	-

(000's omitted)

Issuer Composition of Non-SLR Investments					
Sr.No.	Issuer	Amount		Extent of Unrated/unlisted Securities	
		31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023
a)	PSUs	1,47,416	1,27,416	-	-
b)	FIs	33,856	35,294	-	-
c)	Banks	1,760	1,760	1,760	1,760
d)	Private Corporates	-	-	-	-
e)	Subsidiaries / Joint Ventures	-	-	-	-
f)	Others	-	-	-	-
g)	Provision held towards depreciation	-	-	-	-
	Total	1,83,032	1,64,470	1,760	1,760



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

Classification of Investment

(000's omitted)

Sr. No	Particulars	31/03/2024	31/03/2023
1	Classification of Investments		
	Held to Maturity (HTM)	45,13,637	49,64,122
	Held for Trading (HFT)		
	Available for Sale (AFS)	33,75,015	29,02,969
	Total Investments	78,88,652	78,67,091
2	Composition of Investments		
	(A) SLR Investments		
	Central Government Securities	51,88,535	51,84,691
	State Government Securities	25,17,085	25,17,930
	Total (A)	77,05,620	77,02,621
	(B) Non SLR Investments		
	Shares of District/State Co.Op.Banks	1,760	1,760
	Bonds	1,81,272	1,62,710
	Total (B)	1,83,032	1,64,470
	Total Investments (A)+(B)	78,88,652	78,67,091

The Book Value, the Face Value and the Market Value of total Investment portfolio of the Bank are Rs. 78,88,652, Rs. 79,32,015 and Rs.75,78,830 respectively and adequate provision has been made for reduction in market value.

Transactions under Repos during the FY 2023-24

(000's omitted)

Particulars	Minimum Outstanding Balance	Maximum Outstanding Balance	Daily Average Balance	Outstanding as on 31/03/2024
Securities Sold Under Repos	-	-	-	-
Securities Purchased Under Reverse Repos / LAF	-	7,00,000	10,054	-

Transactions under TREPS during the FY 2023-24

(000's omitted)

Particulars	Minimum Outstanding Balance	Maximum Outstanding Balance	Daily Average Balance	Outstanding as on 31/03/2024
Lending	-	13,99,744	2,62,801	-
Borrowing	-	-	-	-

Transactions under SDF during the FY 2023-24

(000's omitted)

Particulars	Minimum Outstanding Balance	Maximum Outstanding Balance	Daily Average Balance	Outstanding as on 31/03/2024
Lending	-	15,10,000	6,57,322	-



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

7) Employee Benefit

A. Defined Contribution Plan

7.1

Bank's Contribution to Provident Fund for the year 2023-24 is Rs 16,632 thousands. Bank has made total payment of Rs 36,049 thousand .

B. Defined Benefit Plan

7.2 Assumptions

Sr. No.	Particulars	Gratuity (Funded)		Leave Encashment(Funded)	
		31-03-2024	31-03-2023	31-03-2024	31-03-2023
I	Discount rate	7.25%	7.25%	7.25%	7.25%
II	Expected return on Plan Assets	7.67%	7.01%- 7.42%	7.67%	7.01%- 7.42%
III	Salary Escalation rate	7.00%	7.00%	7.00%	7.00%
IV	Attrition Rate	1.00%- 3.00%	1.00%- 3.00%	1.00%- 3.00%	1.00%- 3.00%
V	Mortality Table	LIC (2006-08) ultimate	LIC (2006-08) ultimate	LIC (2006-08) ultimate	LIC (2006-08) ultimate

7.3 Table showing change in the Present Value of Projected Benefit Obligation (000's omitted)

Particulars	Gratuity (Funded)		Leave Encashment (Funded)	
	31-03-2024	31-03-2023	31-03-2024	31-03-2023
Present value of obligation at the beginning of the period	1,16,875	1,04,572	1,12,691	93,982
Interest cost	7,302	18,788	1,531	18,060
Current service cost	6,213	6,048	11,658	11,038
(Benefits paid directly by the Employer)	-	-	-	-
(Benefits paid from the Fund)	11,944	12,533	11,818	10,389
Actuarial (Gains)/Losses on Obligations-Due to Change in Demographic Assumptions	-	-	-	-
Actuarial (Gains)/Losses on Obligations-Due to Change in Financial Assumptions	-	-	-	-
Actuarial (Gains)/Loss on obligations-Due to Experience	-	-	-	-
Present value of benefit obligation at the end of the period	1,18,446	1,16,875	1,14,062	1,12,691



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

7.4 Fair Value of Plan Assets

(000's omitted)

Particulars	Gratuity (Funded)		Leave Encashment (Funded)	
	31-03-2024	31-03-2023	31-03-2024	31-03-2023
Fair Value of Plan Assets at the beginning of the period	1,16,875	1,04,572	1,12,691	93,982
Expected Return on Plan Assets	8,516	7,338	8,189	6,598
Contribution by the employer	5,000	17,500	5,000	22,500
Benefits paid from the fund	11,944	12,533	11,818	10,389
Fair Value of Plan Assets at the end of the period	1,18,446	1,16,875	1,14,062	1,12,691

7.5 Amount recognized in Balance Sheet:

(000's omitted)

Particulars	Gratuity (Funded)		Leave Encashment (Funded)	
	31-03-2024	31-03-2023	31-03-2024	31-03-2023
(Present value of obligation at the end of the period)	1,18,446	1,16,875	1,14,062	1,12,691
Fair value of plan assets at the end of the period	1,18,446	1,16,875	1,14,062	1,12,691
Funded Status (Surplus/ (Deficit))	-	-	-	-
Net (Liability)/Asset Recognised in the Balance Sheet	-	-	-	-

7.6 Expenses recognized in the Statement of Profit or Loss:

(000's omitted)

Particulars	Gratuity (Funded)		Leave Encashment (Funded)	
	31-03-2024	31-03-2023	31-03-2024	31-03-2023
Current service cost	6,213	6,049	11,658	11,038
Net Interest cost	-1,213	11,451	-6,658	11,462
Actuarial (Gains)/Loss	-	-	-	-
Expenses recognised in Statement of Profit or Loss	5,000	17,500	5,000	22,500

7.7 Investments under Plan Assets are as follows:

(000's omitted)

Category of Assets	Gratuity (Funded)		Leave Encashment (Funded)	
	31-03-2024	31-03-2023	31-03-2024	31-03-2023
Insurer Managed Funds	1,18,446	1,16,875	1,14,062	1,12,691
Other	-	-	-	-
Total	1,18,446	1,16,875	1,14,062	1,12,691

7.8 In addition to the above bank has made provision of for gratuity and leave encashment for employees above 60 years as under:

(000's omitted)

Particulars	2023-24	2022-23
Gratuity	75	77
Leave encashment	172	127



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

8) Income Tax

Break up of Deferred tax liability (Net) as on 31/03/2024 is as under.

Sr No	Particulars	Deferred tax (Liability)/ Asset as on 31/03/2023	Current year (Charge)/Credit to Profit & loss account.	Deferred tax (Liability)/ Asset as on 31/03/2024
a	Difference between book depreciation and depreciation as per income tax	4,737	3,192	7,929
b	Special Reserve u/s 36(1)(viii) of Income Tax Act, 1961	(10,193)	(3,775)	(13,968)
c	Gratuity & Leave Encashment	156	53	209
	Deferred Tax Liability (Net) (a + b + c)	(5,300)	(530)	(5,830)

9) Related Party Disclosure

Related party disclosure as per RBI circular DOR.ACC.REC.No.45/21.01.018/2021-22 dated 30.08.2021 as follows and as per accounting standard 18.

(000's omitted)

Sr No	Particulars	Key Management Personnel		Relative of Key Management Personnel		Director & their Relative		Total	
		31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023
1	Advances	306	368	-	1,146	963	986	1,269	2,500
	FD OD	-	-	-	-	-	23	-	23
	Loan	306	368	-	1,146	-	-	306	1,514
	Non Financial	-	-	-	-	963	963	963	963
	Maximum during year	817	833	1,146	1,367	2,474	986	4,437	3,186
	FD OD	449	406	-	-	1,511	23	1,960	429
	Loan	368	427	1,146	1,367	-	-	1,514	1,794
	Non Financial	-	-	-	-	963	963	963	963
2	Fixed Deposits at year end	108	688	14	10	91,526	71,946	91,648	72,644
3	Maximum FD During Year	838	1,288	24	70	1,73,547	1,88,465	1,74,409	1,89,823
4	Investment	1	1	3	3	1,969	1,518	1,973	1,522
5	Management Contract	2,196	2,129	-	-	1,412	1,142	3,608	3,271
6	Interest paid on deposits	62	88	1	7	7,327	6,619	7,390	6,714
7	Interest received in loans	17	21	46	91	-	-	63	112
8	Interest received in FD OD	4	9	-	-	8	1	12	10

Relatives of Key Management Personnel.

Amita Kapadia, Shreya Kapadia, Shivani Kapadia, Ankit Kothari, Milind Mistry, Prithviraj Kapadia, Gopal Kapadia, Jyotsna Kapadia, Nalini Bhatia, Neeta Morparia.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

Related Party – Board of Director

Dhanabhai Chimanlal Shah, Anandbhai Sharadchandra Patel, Malav Mahendrabhai Fadia, Satishchandra Sampatraj Shah, Rajendrabhai Maneklal Patel, Sunilbhai Himatbhai Shah, Ninaben Snehalbhai Lavsi, Shirishbhai Anantbhai Joshi, Pavanbhai Rameshchandra Parikh, Rahilbhai Nimeshbhai Shah, Parthiviben Mittalbhai Shah.

Board of Management - External Member

Champaklal Mohanlal Shah, Umeshchandra Kanaiyalal Trivedi, Chinubhai Nathalal Shah,

10) Segment Reporting

As per Accounting standard issued by Institute of Chartered Accountants of India for the segment reporting bank's operation are segregated into following segments.

1 – Treasury

2 – Banking Business - Acceptance of Deposits and Financing

3 – Other banking Business – Other services which includes Demat, Safe Deposit Vault & Franking – E Stamping Services.

As per RBI Master Direction on Financial Statements – Presentation and Disclosures dated 30.08.2021 bank has adopted more reasonable basis to allocate the income and expense and accordingly previous year's figures are regrouped/re classified.

To the extent cost can be identified directly is allocated to respective segment.

Total Interest expense and respective liabilities are bifurcated on the bases of average fund utilized for treasury and average funds utilized for advances.

Secondary segment – Bank caters needs of Indian customer so geographical segment is not given.

(000's omitted)

Business Segment	Treasury		Banking Business		Other Banking Business		Total	
Particulars	2023-24	2022-23	2023-24	2022-23	2023-24	2022-23	2023-24	2022-23
Revenue	7,76,273	6,24,691	12,66,360	10,24,274	50,318	1,61,303	20,92,951	18,10,268
Result	1,17,944	39,442	1,13,419	96,164	27,985	78,595	2,59,348	2,14,201
Unallocated Income							12,704	9,118
Unallocated Expense							92,493	1,05,152
Operating Profit							1,79,559	1,18,167
Income Taxes							35,329	47,360
Extraordinary Profit/Loss							-	-
Net Profit							1,44,230	70,807
Other Information								
Segment assets	99,22,146	90,18,223	1,77,43,079	1,51,02,647	25,866	4,36,802	2,76,91,091	2,45,57,672
Unallocated assets							8,96,372	9,57,588
Total assets							2,85,87,463	2,55,15,260
Segment Liabilities	1,13,53,273	98,01,782	1,41,13,706	1,24,64,339	387	41,874	2,54,67,366	2,23,07,995
Unallocated Liabilities							58,837	2,05,335
Total Liabilities							2,55,26,203	2,25,13,330
Secondary Segment							NIL	



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

11) Disclosure of various information as required by RBI is as under.

(000's omitted)

Sr. No.	Particulars	Year 31.03.2024	Year 31.03.2023
1	Composition of Regulatory Capital		
i)	Common Equity Tier 1 capital (CET 1) / Paid up share capital and reserves (net of deductions, if any)	18,64,556	17,96,027
ii)	Additional Tier 1 capital / Other Tier 1 capital	-	-
iii)	Tier 1 capital (i + ii)	18,64,556	17,96,027
iv)	Tier 2 capital	4,03,686	3,21,086
v)	Total capital (Tier 1+Tier 2)	22,68,242	21,17,113
vi)	Total Risk Weighted Assets (RWAs)	1,48,19,978	1,34,11,971
vii)	CET 1 Ratio (CET 1 as a percentage of RWAs) / Paid-up share capital and reserves as percentage of RWAs		
viii)	Tier 1 Ratio (Tier 1 capital as a percentage of RWAs)	12.59%	13.39%
ix)	Tier 2 Ratio (Tier 2 capital as a percentage of RWAs)	2.72%	2.40%
x)	Capital to Risk Weighted Assets Ratio (CRAR) (Total Capital as a percentage of RWAs)	15.31%	15.79%
xi)	Percentage of the shareholding of		
	a) Government of India	-	-
	b) State Government (specify name)	-	-
	c) Sponsor Bank	-	-
xii)	Amount of paid-up equity capital raised during the year (Net of paid .Redeemed)	(4,664)	(3324)
xiii)	Amount of non-equity Tier 1 capital raised during the year in the nature of specified Instrument Type as per RBI Guidelines	-	-
xiv)	Amount of Tier 2 capital raised during the year in the nature of specified Instrument Type as per RBI Guidelines	-	-
2	Investment		
a	Book Value of Investment	78,88,652	78,67,091
b	Face Value of Investment	79,32,015	79,12,176
c	Market Value of Investment	75,78,830	73,99,343
d	Investment in Non – SLR PSU Bond and Share of State & District Co-operative Bank – Prescribed	10% of Total Deposit as at end of last year	10% of Total Deposit as at end of last year
e	Investment in Non – SLR PSU Bond and Share of State & District Co-operative Bank – Actual	0.82%	0.79%
f	Total Fixed Deposit with other bank (within Limit Prescribed by RBI)	18,27,007	8,77,542
3	Advances & Deposit		
a)	Advances against Real Estate, Construction, Business and Housing		
I	Construction Business	-	-



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

iii	Housing Loan	16,20,467	14,28,792
	(of which under Priority sector)	6,21,128	5,66,906
iii	Advances against Real Estate		
	Commercial Real Estate	10,67,944	9,11,688
	Other Commercial Real Estate (Offices/Shops etc)	-	-
	Other than Housing Loan & CRE	20,24,862	18,53,211
	Total (i to iii)	47,13,273	41,93,691
b)	Advances against Shares/Debentures (within RBI Limit & Prescribed Norms)		
	Sanction Limit	1,55,899	1,38,040
	Outstanding	57,290	45,257
c)	Advances to directors, their relatives, companies/firms in which directors are interested. (other than whole time director)		
	Fund Based		
	Sanction Limit	46,634	9,334
	Outstanding	-	23
	Non Fund Based	963	963
d)	Movement of NPA		
	Gross NPA at the beginning of the year	1,85,783	1,85,726
	Gross NPA at the end of the year	1,60,407	1,85,783
	No of NPA accounts at the end of year	61	68
e)	Movement in Provisions		
	Provision for NPA required as per IRAC Norms	1,44,007	1,69,258
	Total Provision held for NPA	2,85,361	2,70,814
	Excess Provision Held	1,41,354	1,01,556
	Provision for Standard Asset required as per IRAC Norms	68,156	60,198
	Total Provision held for Standard Asset Held	72,869	62,869
	Excess Provision held	4,713	2,671
f)	Priority sector & Weaker section Advance		
	Priority sector advance Prescribed %	60.00%	60.00%
	Priority sector advance Achieved %	69.66%	74.17%
	Weaker section advances prescribed %	11.50%	11.50%
	Weaker section advances achieved %	14.41%	13.11%
g)	Unsecured advances	1,39,809	1,60,783
	Out of above amount of advance for which intangible securities have been taken	-	-
h)	Concentration of Deposits		
	Total deposit of twenty largest depositors	14,94,039	11,48,059
	Percentage of deposit of twenty largest depositors to total deposits of the bank	5.90%	5.20%



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

i)	Concentration of advances		
	Total advances to the twenty largest borrowers	31,31,454	27,93,442
	Percentage of advances to of twenty largest borrowers to total advance of bank	17.13%	17.83%
j)	Concentration of Exposures		
	Total exposure to the twenty largest borrowers/customers	33,01,711	28,58,173
	Percentage of exposures to the twenty largest borrowers/customers to the total exposure of the bank on borrowers/customer.	17.06%	17.81%
k)	Concentration of NPA		
	Total Exposure to the top twenty NPA accounts	1,58,712	1,82,457
	Percentage of exposures to the twenty largest NPA exposure to the total gross NPAs	98.94%	98.21%
4	Contingent Liability		
a)	Amount Transferred to Depositors Education and awareness Fund		
	Opening balance of amount transferred to DEAF	58,111	52,875
	Add: Amount Transferred during year	3,591	6,125
	Less : Amount reimbursed by DEAF towards claims	2,417	888
	Closing balances of amounts transferred to DEAF	59,285	58,111
b)	Contingent liabilities in respect of Bank guarantees, Letters of credit, Forward contracts etc.		
	Letter of Credit	32,537	20,721
	Bank Guarantee	2,05,761	1,66,952
	Total	2,38,298	1,87,673
	Margin as Fixed Deposit	1,55,251	1,16,288
	Margin as other securities	4,28,567	5,14,629
c)	Claims Not Acknowledged as Debt		
	Income Tax Demand	776	-
	Other Suit Filed	12,679	9,457
	Total	3,11,038	2,55,241
5)	Payment towards DICGC Premium	27,768	25,009
	Arrears of DICGC Premium	-	-
6)	Penalty Imposed by RBI	-	2,600
	Banking Regulation Act 1949	-	2,600
	Penalty under Section 35A , 47A (i) (c) read with sections 46 (4) (i) & section 56 of		
	Payment and Settlement system Act 2007	-	-
	Government Securities Act 2006	-	-
7)	Profitability & Other Ratio		
a	Interest Income as a % of Working Funds	7.13%	6.61%



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

b	Non-Interest Income as a % of Working Funds	0.39%	0.83%
c	Operating Profit as a % of Working Funds	0.57%	0.62%
d	Return on Assets	0.53%	0.29%
e	Business (Deposits + Advances) per Employee	1,42,664	1,29,860
f	Profit per Employee	509	260
g	Net Interest Margin	2.06%	2.35%
h	Average Cost of Time Deposit	7.35%	6.33%
i	Average Cost of Total Deposit	6.06%	5.21%
8	Information on complaints received by the bank from customer and from the office of Banking Ombudsman		
a)	Complaint Received by Bank from its Customer		
	Number of complaints pending at beginning of the year	-	-
	Number of complaints received during the year	26	11
	Number of complaints disposed during the year	26	11
	Of which, number of complaints rejected by the bank	-	-
	Number of complaints pending at the end of the year	-	-
b)	Maintainable complaints received by the bank from OBOs		
	Number of maintainable complaints received by the bank from OBOs	7	6
	Of b, number of complaints resolved in favour of the bank by BOs	7	6
	Of b, number of complaints resolved through conciliation/mediation/advisories issued by BOs	-	-
	Of b, number of complaints resolved after passing of Awards by BOs against the bank	-	-
	Number of Awards unimplemented within the stipulated time (other than those appealed)	-	-
c)	Top Five Grounds of complaints received by bank from customer		
	Number of complaints at the beginning of the year	-	-
	Number of complaints received during the year		
	1 - ATM /Debit Cards	2	1
	2 -Account opening/difficulty in operating Account	-	1



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

	3 - Mis-selling/Para banking	0	2
	4- Cheques/drafts/bills	0	1
	5 – Others	3	5
	6 - Internet /Mobile/ Electronic banking	9	1
	7 – Pension and facilities to Sr citizen and differently abled person	5	0
	8 Exchange Coin, Issuance/acceptances of small denomination notes and coins	3	0
	Total	22	11
	% increase/decrease in Number of complaints received over previous year	136%	(45%)
	Number of complaints pending at the end of the year	-	-
	Complain pending beyond 30 days at year end.	-	-
9)	Disclosures on remuneration of Whole time Directors	2,196	2,129
10)	Provision and contingencies		
a	Provision for NPI	-	-
b	Provision for NPA	15,000	20,000
c	Provision for Income Tax	33,500	46,000
d	Other Provision & Contingencies		
	1 Investment Depreciation reserve	-	75,492
	2 Special reserve for long term finance	15,000	10,000
	3 Provision for standard asset	10,000	5,000
11)	Expenditure in excess of 1% of Income	-	-
12)	Reserve fund includes following reserves in the nature of provision as per various regulatory guidelines created from charge against profit & loss account.		
	Standard Asset Provision	72,869	62,869
	Bad Debt reserve as per sec 36 of income tax act	2,31,670	2,17,123
	Investment depreciation Reserve	1,24,189	1,67,765
	Special Reserve For Long term Finance	55,500	40,500
13)	Bancassurance Business	16,382	1,29,212
14)	Amount Drawdown from Reserves		
	Investment Fluctuation Reserve	-	64,572
	Building Fund	4,000	-
	Building Fund as on 31.03.2023 includes fund of Rs. 7000.00 thousand (Rs. 4,000.00 thousand of year 2012-13 and Rs. 3,000.00 thousand of year 2014-15) which was debited from Profit & Loss account and was not created from appropriation of profit.		
	Pursuant to Board resolution, bank has brought back Rs 4,000.00 thousand in current year and Rs 3,000.00 thousand will be brought back in Year 2024-25		



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

12) Asset liability management

Maturity pattern of certain items of assets and liabilities as at 31.03.2024

(000's omitted)

Particulars & Days	1	2 to 7	8 to 14	15 to 28	29 to 3 month	3 to 6 month	6 month to 1 year	1 year to 3 year	3 year to 5 year	More than 5 year	Total
Deposits[1]	7,47,789	3,00,148	3,80,925	4,49,128	17,51,601	12,91,749	14,72,835	1,88,80,130	32,138	185	2,53,06,628
Saving	4,48,106	40,000	40,000					47,52,950			52,81,056
Current	2,22,798	40,000	40,000					17,15,853			20,18,651
Term Deposit	76,885	2,20,148	3,00,925	4,49,128	17,51,601	12,91,749	14,72,835	1,24,11,327	32,138	185	1,80,06,921
Advances	2,60,591	88,073	1,48,364	1,45,258	4,76,000	6,85,588	12,41,853	96,17,684	15,53,983	9,16,184	1,51,33,578
Loan	10,591	47,635	1,06,783	1,44,907	4,76,000	6,62,480	12,41,853	36,35,104	15,47,079	7,62,680	86,35,112
Cash Credit	2,50,000	40,000	40,000	-	-	-	-	59,82,580	-	-	63,12,580
Other	-	438	1,581	351	-	23,108	-	-	-	-	25,478
NPA	-	-	-	-	-	-	-	-	6,904	1,53,504	1,60,408
Investments	-	-	-	-	-	-	-	83,472	2,50,764	75,54,418	78,88,653

Maturity pattern of certain items of assets and liabilities as at 31.03.2023

(000's omitted)

Particulars & Days	1	2 to 7	8 to 14	15 to 28	29 to 3 month	3 to 6 month	6 month to 1 year	1 year to 3 year	3 year to 5 year	More than 5 year	Total
Deposits [1]	5,73,210	1,74,060	1,94,792	2,04,862	6,93,462	11,56,409	21,10,313	1,69,10,612	41,562	1,990	2,20,61,272
Saving	3,67,901	40,000	40,000	-	-	-	-	40,31,113	-	-	44,79,014
Current	1,78,574	40,000	40,000	-	-	-	-	14,65,250	-	-	17,23,824
Term Deposit	26,735	94,060	1,14,792	2,04,862	6,93,462	11,56,409	21,10,313	1,14,14,249	41,562	1,990	1,58,58,434
Advances	2,60,249	62,732	1,52,418	1,19,110	4,08,776	5,88,400	10,54,911	83,93,843	12,12,132	10,23,399	1,32,75,970
Loan	10,249	22,732	1,12,418	1,19,110	4,06,775	5,87,400	10,54,911	27,80,142	12,12,132	8,40,690	71,46,559
Cash Credit	2,50,000	40,000	40,000	-	-	-	-	56,13,701	-	-	59,43,701
Other	-	-	-	-	2,001	1,000	-	-	-	-	3,001
NPA	-	-	-	-	-	-	-	-	-	1,82,709	1,82,709
Investments	-	-	-	-	-	-	16,276	48,632	2,50,075	75,52,108	78,67,091

13) Suppliers / service providers covered under Micro, Small, Medium Enterprises Development Act, 2006, have not furnished the information regarding filing of necessary memorandum with the appropriate authority. Therefore, information relating to cases of delays in payments to Micro and Small enterprise or of interest payments due to delays in such payments could not be given.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

CASH FLOW STATEMENT FOR THE YEAR ENDED ON 31.03.2024

PARTICULARS	31.03.2024		31.03.2023	
Cash Flow From Operating Activities				
Net Profit before tax for the Year	16,97,34,962		11,19,72,518	
Add : Depreciation & Written Off	3,14,23,476		4,30,40,773	
Add : Loss on sale of asset	1,14,681		99,090	
Add : Amortization of Premium in Govt. Securities	23,95,653		26,88,348	
Add : Provision	4,00,00,000		11,04,91,738	
Less : Profit on sale of Fixed Asset	-37,039		-7,219	
Incr/Decr in Fixed Deposit with other other banks and Call Money & LAF	-94,94,64,977		9,32,27,744	
Incr/Decr in Investment	-2,39,57,499		14,17,76,999	
Incr/Decr in Advance given to customers	-1,85,76,74,353		-1,98,86,22,129	
Incr/Decr in Other Asset other than IT & AT	35,70,05,317		-32,73,41,964	
Incr/Decr in Other Liabilities	-23,51,39,522		17,15,29,823	
Incr/Decr in Deposits from customers	3,24,53,56,196		1,34,75,23,119	
Incr/Decr in reserves & other funds	-4,53,59,743		-9,94,050	
Less : Payment of Taxes	-1,77,46,518		-3,40,23,005	
Cash Flow From Operating Activities		71,66,50,634		-32,86,38,215
Cash Flow From Investing Activities				
Purchase of Fixed Asset	-1,55,51,829		-1,42,48,440	
Sales Realization of Fixed Asset	69,730		2,13,444	
Cash Flow from Investing Activities		-1,54,82,099		-1,40,34,996
Cash Flow from Financing Activities				
Issue/Redemption of Share Capital	-46,64,475		-33,24,500	
Dividend Payment	-2,97,82,050		-2,86,42,506	
Cash Flow from Financing Activities		-3,44,46,525		-3,19,67,006
Incr/Decr in Cash & Cash Equivalents	66,67,22,010		-37,46,40,217	
Opening Cash & Cash Equivalents		1,86,39,91,425		2,23,86,31,642
Closing Cash & Cash Equivalents		2,53,07,13,435		1,86,39,91,425

Cash & Cash Equivalents

As at 31-03-2024

As at 31-03-2023

Cash Balance
Balance with Banks (other than FDs)

10,65,44,645
2,42,41,68,790

11,25,53,510
1,75,14,37,915

TOTAL

2,53,07,13,435

1,86,39,91,425

As per our report of even date attached herewith

For, M/s. Jain Kedia & Sharma

Chartered Accountants

(Firm Registration No:103920W)

Dhanabhai Chimanlal Shah

Chairman

(Ramesh Kedia)

Partner

M. No. 035997

Ashok Kapadia
**General Manager &
Chief Executive Officer**

Anandbhai Sharadchandra Patel

Vice Chairman

Place : Ahmedabad

Date : 12/06/2024



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

બેંકની છેલ્લા ૫૨ વર્ષની પ્રગતિ દર્શાવતા આંકડા

(રૂ. કરોડમાં)

વર્ષ	શાખા	સભ્યો	શેર કેપીટલ રૂ.	રીઝર્વ ફંડ અને અન્ય ફંડો રૂ.	ડીપોઝીટ રૂ.	ધિરાણ રૂ.	વર્કીંગ કેપીટલ રૂ.	નફો રૂ.	ડિવિડન્ડની વહેંચણી ટકા
૧૯૭૨-૧૯૭૩	૧	૭૮૩	૦.૦૮	૦.૦૧	૧.૦૨	૦.૭૦	૧.૨૦	૦.૦૧	૮%
૧૯૭૩-૧૯૭૪	૧	૮૮૫	૦.૧૦	૦.૦૧	૧.૩૭	૦.૮૫	૧.૫૮	૦.૦૪	૮%
૧૯૭૪-૧૯૭૫	૨	૧૧૭૦	૦.૧૩	૦.૦૪	૧.૭૪	૧.૦૨	૨.૦૪	૦.૦૬	૮%
૧૯૭૫-૧૯૭૬	૨	૧૨૨૬	૦.૧૫	૦.૦૮	૨.૦૨	૧.૦૫	૨.૩૮	૦.૦૭	૮%
૧૯૭૬-૧૯૭૭	૨	૧૩૮૩	૦.૧૮	૦.૧૩	૨.૦૩	૧.૪૦	૨.૪૮	૦.૦૮	૮%
૧૯૭૭-૧૯૭૮	૨	૧૪૮૮	૦.૨૧	૦.૧૮	૨.૫૦	૧.૮૧	૩.૦૮	૦.૧૧	૧૨%
૧૯૭૮-૧૯૭૯	૪	૧૮૧૪	૦.૨૫	૦.૨૭	૨.૮૬	૨.૪૮	૩.૭૩	૦.૧૩	૧૨%
૧૯૭૯-૧૯૮૦	૪	૨૦૦૭	૦.૨૮	૦.૩૬	૩.૬૩	૨.૮૮	૪.૭૨	૦.૨૦	૧૨%
૧૯૮૦-૧૯૮૧	૬	૨૮૪૪	૦.૪૧	૦.૫૦	૬.૮૪	૭.૧૨	૧૦.૦૬	૦.૩૫	૧૨%
૧૯૮૧-૧૯૮૨	૭	૩૪૩૪	૦.૫૪	૦.૭૪	૧૧.૨૧	૮.૨૨	૧૪.૩૨	૦.૫૮	૧૨%
૧૯૮૨-૧૯૮૩	૭	૩૮૮૪	૦.૭૦	૧.૧૪	૧૩.૮૦	૧૩.૨૨	૧૮.૩૬	૦.૭૨	૧૨%
૧૯૮૩-૧૯૮૪	૭	૪૩૫૬	૦.૭૬	૧.૬૬	૧૫.૩૨	૧૧.૬૫	૧૮.૭૬	૦.૭૪	૧૨%
૧૯૮૪-૧૯૮૫	૮	૪૮૫૦	૦.૮૫	૨.૨૩	૧૭.૩૧	૧૨.૬૨	૨૨.૮૦	૦.૮૦	૧૨%
૧૯૮૫-૧૯૮૬	૮	૫૫૦૬	૧.૦૧	૨.૮૫	૨૩.૪૭	૧૮.૪૮	૨૮.૭૦	૧.૦૧	૧૨%
૧૯૮૬-૧૯૮૭	૮	૫૮૭૬	૧.૧૫	૩.૫૨	૨૪.૫૦	૧૮.૫૮	૩૧.૮૭	૧.૦૨	૧૨%
૧૯૮૭-૧૯૮૮	૮	૬૬૧૮	૧.૨૭	૪.૧૬	૨૫.૫૭	૨૧.૫૪	૩૪.૫૦	૧.૦૬	૧૨%
૧૯૮૮-૧૯૮૯	૮	૬૮૬૪	૧.૩૦	૪.૮૩	૨૭.૩૦	૨૩.૧૮	૩૭.૪૪	૧.૧૨	૧૨%
૧૯૮૯-૧૯૯૦	૮	૭૨૫૨	૧.૪૨	૫.૭૭	૩૧.૦૮	૨૪.૭૭	૪૨.૮૭	૧.૨૪	૧૨%
૧૯૯૦-૧૯૯૧	૮	૭૫૧૭	૧.૫૩	૬.૮૪	૩૬.૫૨	૨૮.૫૭	૫૬.૫૦	૧.૪૪	૧૨%
૧૯૯૧-૧૯૯૨	૮	૭૬૮૦	૧.૫૮	૮.૫૮	૪૩.૮૦	૨૮.૮૮	૬૩.૮૪	૧.૪૩	૧૨%
૧૯૯૨-૧૯૯૩	૮	૮૦૨૭	૧.૬૭	૧૦.૮૩	૫૦.૮૭	૨૮.૮૦	૭૩.૫૮	૨.૦૮	૧૨%
૧૯૯૩-૧૯૯૪	૮	૮૫૬૭	૧.૮૭	૧૩.૨૨	૬૩.૨૩	૩૮.૬૮	૮૭.૦૭	૨.૫૨	૧૨%
૧૯૯૪-૧૯૯૫	૧૧	૮૨૭૫	૨.૦૮	૧૫.૨૪	૭૩.૩૭	૪૪.૮૮	૮૮.૨૫	૨.૮૧	૧૫%
૧૯૯૫-૧૯૯૬	૧૨	૧૦૦૪૨	૨.૬૩	૧૮.૮૧	૧૦૩.૬૮	૬૭.૮૭	૧૩૮.૭૭	૪.૩૩	૧૫%
૧૯૯૬-૧૯૯૭	૧૩	૧૦૫૮૭	૩.૧૪	૨૪.૭૧	૧૨૭.૪૦	૮૦.૨૩	૧૬૭.૩૪	૫.૦૫	૧૫%
૧૯૯૭-૧૯૯૮	૧૫	૧૧૧૨૭	૩.૫૮	૩૦.૦૦	૧૭૦.૪૨	૮૮.૨૪	૨૧૮.૭૦	૫.૮૬	૧૫%
૧૯૯૮-૧૯૯૯	૧૫	૧૧૫૮૪	૩.૮૪	૩૫.૩૮	૨૫૮.૬૬	૧૦૦.૧૮	૩૧૪.૧૮	૫.૪૫	૧૫%
૧૯૯૯-૨૦૦૦	૧૫	૧૨૦૮૭	૪.૫૦	૪૦.૩૦	૩૦૪.૧૭	૧૧૫.૧૧	૩૬૬.૮૨	૬.૮૦	૧૫%
૨૦૦૦-૨૦૦૧	૧૫	૧૨૫૪૮	૫.૧૪	૪૮.૫૭	૨૬૮.૪૩	૧૨૫.૬૨	૩૫૩.૧૮	૭.૨૬	૧૮%
૨૦૦૧-૨૦૦૨	૧૫	૧૨૫૬૨	૫.૦૫	૫૫.૭૬	૨૩૭.૨૪	૧૦૪.૨૦	૩૧૩.૮૪	૪.૫૮	૧૮%
૨૦૦૨-૨૦૦૩	૧૫	૨૦૬૩૦	૫.૦૦	૬૨.૩૦	૧૮૫.૮૬	૮૮.૬૨	૨૭૮.૦૭	૫.૫૦	૧૮%
૨૦૦૩-૨૦૦૪	૧૫	૨૨૦૪૦	૫.૧૬	૬૮.૨૬	૨૧૮.૩૪	૮૦.૬૧	૩૦૭.૬૮	૫.૧૨	૧૮%
૨૦૦૪-૨૦૦૫	૧૫	૨૩૨૭૩	૫.૪૮	૭૪.૫૪	૨૪૫.૪૨	૧૦૫.૭૭	૩૩૭.૭૮	૩.૦૭	૧૮%
૨૦૦૫-૨૦૦૬	૧૫	૨૪૧૦૫	૬.૧૪	૭૮.૪૦	૨૮૭.૮૧	૧૦૬.૦૮	૩૮૪.૪૦	૪.૫૭	૧૮%
૨૦૦૬-૨૦૦૭	૧૫	૨૫૦૧૫	૭.૦૧	૭૮.૬૮	૩૦૮.૮૦	૧૨૮.૭૬	૪૨૨.૨૫	૩.૦૦	૧૫%
૨૦૦૭-૨૦૦૮	૧૫	૨૫૭૮૩	૮.૫૫	૭૮.૮૮	૩૮૮.૧૮	૧૭૦.૫૮	૫૦૨.૧૪	૩.૩૨	૧૫%
૨૦૦૮-૨૦૦૯	૧૮	૨૮૦૦૬	૧૧.૨૬	૮૧.૦૩	૪૨૪.૫૫	૨૧૪.૦૦	૫૩૫.૦૪	૩.૮૮	૧૫%
૨૦૦૯-૨૦૧૦	૨૦	૨૮૭૩૩	૧૨.૮૮	૮૨.૬૮	૫૦૮.૫૧	૨૫૫.૮૦	૬૨૧.૮૦	૩.૬૪	૧૨%
૨૦૧૦-૨૦૧૧	૨૦	૨૮૨૧૧	૧૪.૫૭	૮૮.૧૮	૫૬૫.૧૫	૩૧૪.૭૮	૭૪૬.૩૮	૪.૫૨	૧૨%
૨૦૧૧-૨૦૧૨	૨૦	૨૮૨૩૦	૧૪.૮૪	૮૨.૫૭	૬૪૨.૫૬	૩૬૭.૩૮	૮૮૦.૭૮	૪.૬૭	૧૫%
૨૦૧૨-૨૦૧૩	૨૦	૨૮૩૩૮	૧૫.૬૪	૮૫.૮૪	૭૪૬.૮૮	૪૨૪.૮૭	૮૫૩.૮૩	૫.૬૭	૧૨%
૨૦૧૩-૨૦૧૪	૨૦	૨૮૮૧૫	૧૫.૮૩	૧૦૦.૨૫	૮૭૨.૭૮	૫૦૮.૨૩	૧૦૪૩.૩૧	૫.૮૪	૧૨%
૨૦૧૪-૨૦૧૫	૨૦	૨૨૧૫૮	૧૫.૨૨	૧૦૪.૭૪	૧૦૩૮.૧૮	૫૮૮.૪૫	૧૧૮૦.૦૮	૭.૮૫	૧૨%
૨૦૧૫-૨૦૧૬	૨૩	૧૮૬૨૩	૧૫.૩૮	૧૧૧.૨૨	૧૧૪૨.૬૧	૬૭૮.૧૮	૧૩૦૨.૫૮	૭.૨૦	૧૨%
૨૦૧૬-૨૦૧૭	૨૩	૨૦૦૦૮	૧૬.૧૩	૧૧૮.૧૩	૧૩૫૫.૪૩	૭૨૮.૪૮	૧૫૨૩.૮૮	૮.૮૬	૧૨%
૨૦૧૭-૨૦૧૮	૨૩	૨૦૩૨૭	૧૮.૩૫	૧૨૮.૬૦	૧૩૬૬.૫૮	૮૦૧.૪૭	૧૫૫૧.૪૦	૧૦.૨૫	૧૨%
૨૦૧૮-૨૦૧૯	૨૩	૨૦૭૮૧	૨૦.૧૪	૧૩૮.૮૫	૧૪૮૮.૫૦	૧૦૦૭.૮૭	૧૭૦૧.૨૫	૧૨.૦૩	૧૨%
૨૦૧૯-૨૦૨૦	૨૩	૨૧૦૨૩	૨૧.૪૩	૨૦૨.૧૩	૧૬૬૩.૨૭	૧૦૪૧.૧૫	૧૮૩૦.૬૬	૧૪.૩૩	૧૨%*
૨૦૨૦-૨૦૨૧	૨૩	૨૨૪૪૮	૨૩.૩૮	૨૧૬.૪૬	૧૮૬૭.૭૨	૧૦૪૩.૮૨	૨૨૫૦.૧૦	૧૨.૪૨	૧૫%
૨૦૨૧-૨૦૨૨	૨૩	૨૨૩૭૮	૨૪.૭૪	૨૨૨.૧૭	૨૦૭૧.૩૭	૧૧૨૮.૭૩	૨૩૬૮.૪૦	૧૨.૮૦	૧૨%
૨૦૨૨-૨૦૨૩	૨૩	૨૩૩૬૮	૨૪.૪૧	૨૬૨.૨૪	૨૨૦૬.૧૩	૧૩૨૭.૫૮	૨૫૫૫.૩૦	૧૩.૫૪	૧૨%
૨૦૨૩-૨૦૨૪	૨૩	૨૪૦૮૩	૨૩.૮૪	૨૬૩.૭૬	૨૫૩૦.૬૬	૧૫૧૩.૩૬	૨૮૫૩.૮૪	૧૮.૪૨	૧૨% (સુચિત)

* રિઝર્વ બેંકની સુચના અનુસાર ડિવિડન્ડની વહેંચણી કરેલ નથી.



Nutan Nagarik Sahakari Bank Ltd.

(Multi State-Scheduled Bank)

Ahmedabad

Branches Details

1. **Maskati Market : #**
2-E, Maskati Market, Kapasia Bazar, Ahmedabad-380002.
Ph.: 22138011, 22138012, 22138013 M.: 8980036902 E-mail: maskati@nutanbank.com
 2. **New Cloth Market :**
New Cloth Market, O/s Raipur Darwaja, Ahmedabad-380002.
Ph.: 22114136, 22114150 E-mail: newcloth@nutanbank.com
 3. **Shanti Commercial Centre : (E)**
Nagar Sheth's Vando, Gheekanta Road, Ahmedabad-380001.
Ph.: 25508914, 25508881 M.: 8980036904 E-mail: shanticomm@nutanbank.com
 4. **Ashram Road :**
9, Shilp-II, Nr. Vikram Chambers, Ashram Road, Ahmedabad-380009.
Ph.: 27541031, 27543829 M.: 8980036905 E-mail: ashramroad@nutanbank.com
 5. **Rakhial : # (E)**
Vora Chambers, Opp. Tubewell Station, Nr. Rakhial Char Rasta, Ahmedabad-380023.
M.: 8980036906 E-mail: rakhial@nutanbank.com
 6. **Bapunagar :**
11, Sukhsagar Complex, Opp. Dinesh Chambers, Bapunagar, Ahmedabad-380024.
Ph.: 22200084 M.: 8980036907 E-mail: bapunagar@nutanbank.com
 7. **Vasna : * #**
Jin Darshan Building, Opp. Vasna Bus Stand, Sarkhej Road, Vasna, Ahmedabad-380007.
Ph.: 26605486, 26601898 M.: 8980036908 E-mail: vasna@nutanbank.com
 8. **Drive-in Road (Memnagar) : * #**
Ground Floor, Yashasvi Elegance, Near Vijay Char Rasta, Ahmedabad-380009.
Ph.: 27912761, 27913822 M.: 8980036909 E-mail: drivein@nutanbank.com
 9. **Panjarapole : ***
17-18-19, Kamdhenu Complex, Opp. Sahajanand College, Panjarapole, Ahmedabad-380015.
Ph.: 26302109, 26307986 M.: 8980036910 E-mail: panjarapole@nutanbank.com
 10. **Jodhpur-Satellite Road : * #**
129-Vrundavan-1, 132' Ring Road, Satellite Road, Ahmedabad-380015.
Ph.: 26779694, 26779385 M.: 8980036911 E-mail: satellite@nutanbank.com
 11. **Law Garden : * (E)**
GF, Opp. Samartheshwar Mahadev, Nr. Law Garden, Ellisbridge, Ahmedabad-380006.
Ph.: 26443714, 26445229 M.: 8980036912 E-mail: lawgarden@nutanbank.com
 12. **Isanpur : ***
Bhavna Flat, Nr. Isanpur Bus Stand, Isanpur, Ahmedabad-382443.
Ph.: 25734414, 25735945 M.: 8980036913 E-mail: isanpur@nutanbank.com
 13. **Naranpura : ***
Nr. Patrakar Colony, Vijaynagar Corner, Naranpura, Ahmedabad-380013.
Ph.: 27431043, 27431190 M.: 8980036914 E-mail: naranpura@nutanbank.com
 14. **Narayannagar Road : ***
6, Rakesh Co. op. Hou. Soc. Ltd., Nr. Shantivan Bus Stand, Narayannagar, Ahmedabad-380007.
Ph.: 26670226, 26670204 M.: 8980036915 E-mail: narayannagar@nutanbank.com
 15. **New Sharda Mandir Road : * #**
49, Vasantkunj Society, New Sharda Mandir Road, Paldi, Ahmedabad-380007.
Ph.: 26607399, 26601454 M.: 8980036916 E-mail: shardamandir@nutanbank.com
 16. **Vejalpur : ***
4, Ground Floor, Regency Plaza, Opp. Rahul Tower, 100 ft. Road, Vejalpur, Ahmedabad-380015.
M.: 8970036917, 8488833893 E-mail: vejalpur@nutanbank.com
 17. **Thaltej : ***
003, "Abhishree Adroit" Building, Ground Floor, Nr. Swaminarayan Temple, Mansi Cross Road, Ahmedabad-380015.
M.: 8980036918, 9714077777 E-mail: thaltej@nutanbank.com
 18. **Maninagar : ***
1 to 4, Swastik Plaza, Bhairavnath Road, Vallabhawadi, Maninagar, Ahmedabad-380008.
Ph.: 25466650 M.: 8980036919 E-mail: maninagar@nutanbank.com
 19. **Changodar :**
Shop No. 12 & 13, Kailash Avenue, Ashvamegh Estate, Sarkhej-Bavla Highway, Changodar, Ahmedabad-382210.
M.: 8980036920 E-mail: changodar@nutanbank.com
 20. **Andheri (W) Mumbai :**
Shop No. 5 & 6, Ground Floor, Om-Viraj Co.op.Hos.Society Ltd., Paliram Road, Andheri (West), Mumbai-400058.
Ph.: 022-26205703, 26707165 E-mail: andheri@nutanbank.com
 21. **Ring Road, Surat :**
1004-05-06, Krishna Textile Market, Umarwada, Ring Road, Surat-395002.
Ph.: 0261-2349625, 2349626 E-mail: surat@nutanbank.com
 22. **Odhav : ***
B-Block, Shop No. 7, Ground Floor, Barcelona Multiple Business Campus, Nr. Odhav Ring Road Circle, Odhav, Ahmedabad-382415.
Ph.: 079-29705780-81 M.: 8980036982 E-mail: odhav@nutanbank.com
 23. **Bopal : ***
Shop No. 16 & 17, Ground Floor, Orchid Centre, South Bopal, Opp. Safal Parisar, Bopal, Ahmedabad-380058.
Ph.: 02717-298410, 298491 M.: 8980049281 E-mail: bopal@nutanbank.com
- Demat Department :**
1st Floor, Opp. Samartheshwar Mahadev, Nr. Law Garden, Ellisbridge, Ahmedabad-380006.
Ph.: 26425591, 26564715 E-mail: demat@nutanbank.com

* (With Safe Deposit Vault Facility)

#(With Stamp Franking Facility)

E (E-Stamping)



નૂતન નાગરિક સહકારી બેંક લિ.

મલ્ટી સ્ટેટ શિક્ષણ બેંક

હેડ ઓફિસ : સમર્થશ્વર મહાદેવ મંદિર સામે, લો-ગાર્ડન પાસે, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬
ફોન: ૦૭૯-૨૬૪૪૩૭૨૪, ૨૬૪૪૪૫૫૮ • ઇમેઇલ : admin@nutanbank.com • વેબસાઇટ:www.nutanbank.com
GSTIN No.:24AAALN0005C1ZZ